

100 PRINCIPLES FOR PURPOSEFUL LIVING
(THE TRADITION OF THE PROPHET)
THIS BOOK IS COPY RIGHT FREE

હેતુમય જીવનના ૧૦૦ સિધ્યાંતો

(પણગામ્ભર સાહેબ ની વાતો)

ગુજરાતી પ્રથમ આવૃત્તિ
અંગ્રેજી તારીખ: ૨૮ ઓપ્રીલ, ૨૦૨૨
હિજરી સન: ૨૭ રમ્જાન, ૧૪૪૩

લેખક: મૌલાના વલિદુલીનખાન
અનુવાદ: ડૉ. અબ્ડુલગાની મહેસાહીયા

આ બુક હિમાં મૌલાના અનસ મલેક પાસેથી મંગાવી શકો છો.
મોબાઇલ નં. ૮૮૨૪૦ ૮૪૫૫૫



અનુક્રમણિકા-Content

વિગત	પેજ	વિગત	પેજ
(૧) ઈલ્બ-વિધ્યાની ઈસ્લામમાં અગત્યતા	૦૫	(૨૮) બે અલગ અલગ ગુણો	૧૭
(૨) ઈલ્બ મેળવવું	૦૫	(૨૯) સફળતા વૈર્યથી મળે છે	૧૭
(૩) શિખવા માટેનો અદ્યમ ઉત્સાહ	૦૬	(૩૦) મુકાબલાથી દુર રહો	૧૭
(૪) જ્ઞાનનો લંડાર	૦૬	(૩૧) તમારાથી નીચાને જુઓ	૧૮
(૫) જ્ઞાન પ્રાપ્ત કરવાની કળા	૦૬	(૩૨) ટાઈમ પાસ	૧૮
(૬) જ્ઞાન ની લેટ	૦૭	(૩૩) નિરાશા કદીય નહીં	૧૯
(૭) જ્ઞાનની ઉત્તમતા	૦૭	(૩૪) ઉચ્ચતમ નૈતિકતા	૧૯
(૮) જ્ઞાનનું દૃષ્ટર (રેક્રૂ) રાખો	૦૮	(૩૫) નિઃસ્વાર્થતા	૨૦
(૯) જ્ઞાન ખાતર જ્ઞાન	૦૮	(૩૬) દુઃખ્તા ઉન્મુલન	૨૦
(૧૦) બીન લાભકારી જ્ઞાન	૦૯	(૩૭) પાપ શું છે?	૨૧
(૧૧) એક વિક્સિત વ્યક્તિત્વ	૦૯	(૩૮) પ્રોશ્નિના હક્ક	૨૧
(૧૨) છેઓ વધુ જ્ઞાના હોય તમને પૂછો	૧૦	(૩૯) યુવાનો માટે ચંચેદના અને વૃદ્ધ માટે માન	૨૨
(૧૩) ઈશ્વરીય ઈનામોમાં વિંતન	૧૦	(૪૦) કરારની પરિપૂર્ણતા	૨૨
(૧૪) પ્રતિબિંબની પ્રક્રિયા	૧૦	(૪૧) ભલાઈનો બદલો	૨૨
(૧૫) શિખવામાં નમૃતા	૧૧	(૪૨) આન્યની તકલીફથી ખુશ ન થત્તુ	૨૩
(૧૬) શિક્ષણ અને તાલીમ	૧૧	(૪૩) આન્ય માટે સારો અલિપ્રાય રાખવો	૨૩
(૧૭) જ્ઞાન અને ગંભીરતા	૧૨	(૪૪) આભારી બનો	૨૪
(૧૮) જ્ઞાનમાં વૃદ્ધિ	૧૨	(૪૫) ભૂલનો સ્વિકાર કરવો	૨૫
(૧૯) કોઈ જ બહાનું નહીં	૧૩	(૪૬) અંતરાત્માનો અવાજ	૨૫
(૨૦) અંત:પ્રજ્ઞા માર્ગદર્શક બને છે.	૧૩	(૪૭) દ્વસ્ત પાણો આપો-(અમાનતો અમાનતદારોને પાણી આપો)	૨૬
(૨૧) ડહાપડા	૧૩	(૪૮) શાંતિની સંસ્કૃતિ	૨૬
(૨૨) આશાવંત રહેવું	૧૪	(૪૯) શાંતિવાદ	૨૭
(૨૩) ટકાઉ કિયા	૧૪	(૫૦) શાંતિપૂર્ણ નાગરિક	૨૭
(૨૪) સમયનું ભાન રાખવું	૧૫	(૫૧) કોઈને ય નુકશાન ન પહોંચાડો	૨૮
(૨૫) હેતુમય જીવન	૧૫	(૫૨) મહાન શક્તિ	૨૮
(૨૬) લાભનો સિધ્યાંત	૧૬	(૫૩) સમાધાન ઉત્તમ છે	૨૮

હેતુમય જવના ૧૦૦ સિંગારો

(૨૭) મૌનમાં સફળતા	૧૬	(૪૮) સામાજિક સેવા	૨૮
(૪૫) માનવ માત્ર એક સમાન	૩૦	(૭૮) આર્થિક સ્થિરતા	૪૧
(૫૬) પરામર્શનું મહત્વ-સલાહનું મહત્વ	૩૦	(૭૯) ઈશ્વરીય જોગાવાઈ	૪૨
(૫૭) કોઈનાથી ય ગ્રાણ હિંદુસથી વધુ અબોલા...	૩૧	(૮૦) સંતોષ	૪૨
(૫૮) રિપ્યકારવા પહેલાં બરાબર તપાસી લો	૩૧	(૮૧) બીજા પાસે કશંથ ન માંગો	૪૩
(૫૯) દ્રેક માનવીઓ આપણા ભાઈઓ જ છે	૩૨	(૮૨) વેપાર એ આજીવિકાનો મુખ્ય સ્ત્રોત છે	૪૩
(૬૦) ગ્રાણ ત્યાજ્ય વસ્તુઓ	૩૨	(૮૩) આજીવિકા	૪૪
(૬૧) દ્રેક જવાબદાર છે	૩૩	(૮૪) જીબને વશમાં રાખવી	૪૪
(૬૨) દ્રેકને મદદરૂપ થાણો	૩૪	(૮૫) ગીબત-અપશબ્દો નું પ્રાયશ્ચિત	૪૫
(૬૩) સૌભ્ય આચરણ	૩૪	(૮૬) મહાન સલાહ	૪૫
(૬૪) દ્યા માટેના સૂત્રો	૩૫	(૮૭) ધીરજ રાખવી અને ટાળવું	૪૫
(૬૫) પરસ્પર આદરભાવ	૩૫	(૮૮) એકપક્ષીય સહન કરવું	૪૬
(૬૬) દ્રેક ધર્મને માન આપવું	૩૬	(૮૯) ટાળવાની રીત	૪૬
(૬૭) દુશ્મનમાં ભિત્ર	૩૬	(૯૦) ધીરજમાં જ સફળતા છે	૪૭
(૬૮) મૂદૃતાનો અસાવ	૩૭	(૯૧) ઓછા અનિષ્ટ સાથે સંમત થવું	૪૭
(૬૯) સાદાઈનું મહત્વ	૩૭	(૯૨) સહનશીલતાથી મુકાબલો કરો	૪૮
(૭૦) સ્વર્ઘતાની અગત્યતા	૩૮	(૯૩) ગુર્સો ન કરો	૪૮
(૭૧) મધ્યમાર્ગપણું	૩૮	(૯૪) ગુર્સાનો ઉપાય	૪૮
(૭૨) નમ્રતા દ્વારા ઉન્નતિ	૩૮	(૯૫) શયતાનથી ઈશ્વરનો આશ્રય માંગવો	૪૮
(૭૩) નકારો ખર્ચ	૩૮	(૯૬) શક્તિશાળી કોડા?	૪૮
(૭૪) સામુહિક આશર્વાદ	૩૮	(૯૭) તકલીફમાં રાહત	૫૦
(૭૫) ન્યાય માટે ની માંગણી	૪૦	(૯૮) સરળ રસ્તો પસંદ કરો	૫૦
(૭૬) પોતાના અધિકાર કરતાં વધુ લેવું	૪૦	(૯૯) તમને જે ન ગમતું હોય પણ	૫૧
(૭૭) જેવું કરશો તેવું જ પામશો	૪૧	(૧૦૦) એક પ્રાર્થના	૫૧



પ્રસ્તાવના



પયગમબરે ઈસ્લામ(૩)એ એક વખત ફરમાવ્યું કે દરેક મુસ્લીમ સ્ત્રી પુરુષ ફરજથી બંધાયેલો છે જે તેમણે જ્ઞાન મેળવેલ છે (સંદર્ભ ગ્રંથ સુનન માજા હાદિસ નં. ૨૨૪). રસૂલે ખુદા ની એ પરંપરા રહી છે કે જ્ઞાન મેળવ્યું એ ઈસ્લામમાં બહુજ અગત્યની ચીજ છે. આ એ માટે પણ જરૂરી છે કે તેનાથી અલ્લાહની પહેચાન થઈ શકે છે. (અરબીમાં માર્દેકત કહે છે). આ જ્ઞાન એટલા માટે પણ અગત્યનું છે કે તેનાથી ધાર્મિક અને આધ્યાત્મિક વિકાસ થાય છે. આ દરેકની ફરજ છે. તેનાથી માનવી ની આંતરચેતનામાં વૃદ્ધિ થાય છે. તેનાથી માનવમાં ઊર્ડી વિચારશરણી જાગૃત થાય છે. તે માનવીને ગહન વાસ્તવિકતાઓ સમજવા પ્રેરે છે. માનવના જ્ઞાનનું સ્તર વધારે છે.

જ્ઞાન મેળવવાનો બહુજ અગત્યનો સ્ત્રોત એ પયગમબરે ઈસ્લામની પરંપરાઓ નું જ્ઞાન છે. પયગમબરે ઈસ્લામ મુહમ્મદ(૩)એ એક વખત ફરમાવ્યું “ડહાપણ એ મોમિનની ખોવાયેલી ચીજ છે તે જ્યાંથી મળો લઈ જ લો કારણકે તે તેનીજ ખોવાયેલી ચીજ છે” (સંદર્ભ ગ્રંથ સુનન તિરમીજ હાદિસ નં. ૨૮૭૮). આપ હુશ્વરનું સમગ્ર જીવન આ ડહાપણની વાતને સમર્પિત હતું. આપએ ડહાપણનો રસ્તો અપનાવેલ હતો. આપના દરેક કાર્યમાં ડહાપણ જ ડહાપણ દ્વારા ચૂંચાયા થતું હતું અને આપની જવાબદારીઓ પણ તેનાથી જ વિલુષ્ણિત હતી.

પયગમબરે ઈસ્લામની પરંપરાઓ અને કુરાન એ ડહાપણના મોતી છે. સમગ્ર માનવ જીત માટે આ નાનકડી બુકલેટમાં મેં આપની પરંપરા અને કુરાનની આયતો પરંદ કરીને મોકલી છે અને નાનકડા મેસેજો જેમાંથી ડહાપણ ટપકે છે તે પણ રાખેલ છે. આ એક મહાન સર્ચ લાઈટ છે તેઓ માટે જેઓ પોતાને સુંદર હેતુમય જીવન જીવવા માગે છે. અને બૌદ્ધિક વિકાસ ચાહે છે.

૧૨-૦૩-૨૦૨૧

નવી દિલ્હી (ભારત)

મૌ. વહીદુદ્દીન ખાન

(૧) ઈલ્મ-વિધ્યાની ઈસ્લામમાં અગત્યતા

મુહમ્મદ (ﷺ) પયગમ્બરે ઈસ્લામ ઈ.સ. ૫૭૦ માં જનમ્યા હતા. મક્કામાં, અને અરબસ્તાનમાં તેમણે પોતાની ૪૦ વર્ષની ઉમરે પ્રથમ વહિ (revelation) આવી. જેમાં જ્ઞાન મેળવવા માટે બહુજ લાર આપવામાં આવ્યો છે. (જુઓ કુરાન સૂ. ૮૮/૧, પઢો પોતાના રખના નામથી જેણે પેદા કર્યો).

કોઈજ શંકા વિનાની વાત છે કે ઈલ્મ-જ્ઞાન એ માનવની પ્રગતિનું પ્રથમ પગથીયું છે. ખુદાએ માનવને પ્રાણીના રૂપમાં બનાવ્યો છે. માનવને મર્યાદિત ક્ષમતાઓથી સંપર્ણ કરવામાં આવ્યો છે. પરંતુ માનવમાં બૌદ્ધિક, અસીમ ક્ષમતા પણ આપેલ છે જે પશુમાં નથી.

આ જે બૌદ્ધિક ક્ષમતા આપેલ છે તેનો ઉપયોગ બહુજ જરૂરી છે. જ્ઞાન મેળવવાથી માણસ ઉચ્ચતમ બૌદ્ધિક સ્તર પર પહોંચે છે.

આ જ્ઞાનના કારણે જ માનવ ઈતિહાસ જાણી શકાય છે. તે પ્રકૃતિની રહસ્યમયતા જાણી શકે છે. શીખવાનું મહત્વ એક વ્યક્તિ માટે એટલુંજ જરૂરી છે, જેટલું તે બીજા માટે છે.

(૨) ઈલ્મ મેળવવું

પયગમ્બરે ઈસ્લામ (ﷺ) એ એક વખત ફરમાવ્યું “એ દેરેક મુસ્લિમ પુરુષ અને સ્ત્રીની ફરજ છે કે તેઓ જ્ઞાન મેળવે.” (સંદર્ભ ગ્રંથ સુનન ઈબ્ને માજાહ હદીસ નં. ૨૨૪). આ પરંપરા ઈસ્લામમાં જ્ઞાનનો મહિમા બતાવે છે. જ્ઞાન એ ખુદા-ઈશ્વરને જાણવા માટે બહુજ જરૂરી છે. તેના માટે જ જ્ઞાન મેળવવું ફરજ છે. જ્ઞાનથી માણસમાં જાગૃતિ આવે છે. તેનાથી માનવ મન ની ક્ષિતિજો વિસ્તરે છે. તેનાથી માનવ મનની વિશાળતા વધે છે. જેનાથી જ્ઞાનની ગઢનતા જાણી શકે છે. બીજાના અનુભવોથી શીખવાની ક્ષમતાથી તેનું બૌદ્ધિક સ્તરમાં વૃદ્ધિ થાય છે. જ્ઞાન ધાર્મિક અને આધ્યાત્મિક વિકાસ માટે બહુજ જરૂરી છે. માનવ જ્ઞાનથી જ પરિપક્વ થાય છે. આ બૌદ્ધિક વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે. તેનાથી જ માનવ અને પશુમાં માનવ હોવાનું સ્તર વધે છે.

(૩) શ્રીભવા માટેનો અદમ્ય ઉત્સાહ

ઈસ્લામના ગૌજા ખલીફા હજરત ઉમર દ્વારા પણે કંઈ ને કાઈ શીખતા જ રહેતા તેઓ જેઓને પણ મળતા. આ રીતે સતત શીખવું એ આપના જીવનમાં સતત ચાલતી પ્રક્રિયા હતી.

આ કઈ રીતે શક્ય બન્યું? જ્યારે માણસ કોઈથી ખુલ્લા મનથી મળે છે તો જ આ શક્ય છે. તો જ પરસ્પરથી શીખી શકાય. શીખવાની આ કળાવાળો માણસ પૂર્વગ્રહ અને અભિમાનથી ખાલી હોવો જોઈએ. તેમણે બીજાઓને શીખવાની માનસિકતા દર્શાવવાથી દુર રહેવું જોઈએ. તેની માનસિકતા આવી હોવી જોઈએ. જે કોઈ મળે તે લેવા માટે હું હમેશાં તત્પર રહેશ. કોઈ મારી સૂલો બતાવશે તો પણ હું માનીશ અને તે સુધારવા પ્રયત્ન કરેશ.

શીખવાની પ્રક્રિયામાં શીખનાર નો રોલ પણ શીખવાડનાર જેટલો જ અગત્યનો છે. બીજા પાસેથી શીખવા માટે મગજ શાંત રાખવું બહુજ જરૂરી છે. દુનિયા જ્ઞાન અને વિદ્વતાથી ભરપૂર છે. જેનાથી ઈશ્વરની સમજણ પડે છે. એક જ શરત છે કે માણસમાં યોગ્ય વિચારસરણી, સમજવાની હોવી જોઈએ.

(૪) જ્ઞાનનો સંડર

ઈસ્લામના પયગમ્બરએ એક વખત ફરમાવ્યું “ઉહાપણ એ આપણી ગુમાવેલી વસ્તુ છે તે જ્યાંથી પણ મળે લઈ લો.” (સંદર્ભ ગ્રંથ સુનન અલ તિરમીજ હદ્દીસ નં. ૨૬૮૭). આ પરંપરા આપણને સમજાવે છે કે જ્ઞાનની વैશ્વિકતા. આનો અર્થ છે કે જ્ઞાન, કયાંયથી પણ મળે તે તમામ માનવનો હક્ક છે, લઈ લો. આ દ્વારા સારું છે. આ કોઈની જાગીર નથી. બધા માટે તે સરખી જ છે જે તે મેળવે.

જ્ઞાનની સર્વવ્યાપકતાનો ઘ્યાલ બહુજ અગત્યનો છે. આના સિવાય જ્ઞાનની વ્યાપકતા શક્ય જ નથી. જ્ઞાનનો ખજાનો સમુદ્ધ જેટલો વિશાળ છે, ગમે તેટલું વાપરો ખતમ થતું જ નથી.

(૫) જ્ઞાન પ્રાપ્ત કરવાની કળા

પયગમ્બરે ઈસ્લામ (ﷺ)એ ફરમાવ્યું કે “જ્ઞાન મેળવવા ચીન પણ જવું પડે તો જાઓ.” (સંદર્ભ ગ્રંથ સુઆલુલ ઈમામ હદ્દીસ નં. ૧૫૪૩). આ બતાવે છે કે જ્ઞાન મેળવવામાં

કોઈ પૂર્વગ્રહ કે અવરોધ ન હોવો જોઈએ. ચીનમાં એ સમયે જવું એ આસાન નહોતું તેથી પયગમ્બર સાહેબના કથનનો અર્થ એ છે કે જ્ઞાન મેળવવા માટે દરેક જાતની મુસીબત ઉઠાવો. જ્ઞાન મેળવવામાં કોઈ પણ ચીજ અવરોધરૂપ ન હોવી જોઈએ. જ્ઞાનથી માણસ લોખંડમાંથી સ્ટીલ બની જાય છે.

આ પરંપરા જ્ઞાન મેળવવા માટે મુસાફરી કરવાનું સુચયે છે, તેની અગત્યતા બતાવે છે. મુસાફરીથી માનવીનું માનસિક સ્તર વિસ્તૃત થાય છે. મુસાફરીથી નાનકડી જગ્યાએથી અમાપ વિસ્તૃત પૃથ્વી જોવા મળે છે

(૬) જ્ઞાન ની સેટ

પયગમ્બરે ઈસ્લામ (ﷺ)એ ફરમાવ્યું કે “પિતા તેની ઓલાંજે સૌથી મોટી સેટ યોગ્ય ભાગતર છે.” (સંદર્ભ ગ્રંથ સુનન તિરમીજી હદીસ નં. ૧૮૮૨). અન્ય સેટો તો ક્ષણિક હોય છે, જ્યારે ઈલમની સેટ કાયમી હોય છે, આજીવન પર્યંતની હોય છે. દરેક વ્યક્તિની પ્રથમ સ્કુલ એ પોતાનું ઘર છે અને મા-બાપ તેમના ઉમદા શિક્ષક છે. આપણને આ હદીસથી બે ચીજ જાગ્રત્વા મળે છે. પહેલું એ કે મા-બાપે પોતે જ્ઞાન મેળવવું જોઈએ. કેમકે તેઓ જ જો અજ્ઞાની હશે તો પોતાના બાળકને શિક્ષણ કેવી રીતે આપી શકે? બીજું એ કે ઘર માત્ર બાળકો માટે ઉછેરનું કેન્દ્ર પણ છે જ. દરેકે દરેક ઘર ભાગતરનું પારણું અને જ્ઞાનની તાલીમનું કેન્દ્ર હોવું જોઈએ. અન્યથા એ સંપૂર્ણ નહીં હોય.

(૭) જ્ઞાનની ઉત્તમતા

એક પરંપરા પ્રમાણે, એક વખત પયગમ્બરે ઈસ્લામ (ﷺ)એ ફરમાવ્યું “વિદ્વાનની શ્યાહી એ શહિદના લોહીથી ય વધારે ઉત્તમ છે.” (સંદર્ભ ગ્રંથ તારીખ બગાદાદ, લેખક અલ ખતીબ-અલ બગાદાદ, વોલ્યુમ ૨, પેજ ૧૮૦).

આ હદીસ બતાવે છે કે ઈલમ એટલે કે જ્ઞાન એ દરેક વસ્તુથી ઉત્તમ છે. શીખવું એ જાણે મગજનો ખોરાક છે. તેમાંથી આપણી માનસિક ક્ષિતીજો વિસ્તરે છે. ઉચ્ચ સ્તરનું શિક્ષણ ઉત્તમ માનસિક કાર્ય સાથે સંકાયેલું છે જે વધુ સારું આયોજન કરે છે. કોઈ પણ શારીરિક પ્રવૃત્તિ

એ મર્યાદિત હોય છે. અમૃક સમય પછી આપણો શારીરિક ક્ષમતાની લીમીટ-મર્યાદામાં રહી જઈએ છીએ. પરંતુ જીવની બાબત અલગ છે. તેની કોઈ મર્યાદા હોતી નથી. એક માણસ જે જીવનની સંપત્તિ ધરાવે છે તેની તો કોઈજ મર્યાદા હોતી નથી. તે સંપત્તિ અપાર સંપત્તિ હોય છે.

(૮) જીવનનું દ્વારા (રેકર્ડ) રાખો

પયગમબારે ઈસ્લામ(૩) કહે છે કે “જીવને લખીને રાખો.” (સંદર્ભ ગ્રંથ દારમી હદ્દીસ નં. ૫૧૪). આનો અર્થ એ છે કે જીવને હમેશાં લખીને રાખવું જોઈએ. આવું લખેલું રાખવાથી માણસના મગજમાં જે ચીજ હોય તે પેપર-પાનાઓમાં આવી જાય છે અને લાંબા સમય સુધી રહે છે. અનેક વંશજો સુધી ચાલે છે.

એક રસ્તો જીવનને સચવાયેલું રાખવાનો એ પણ છે કે લખીને તેનું પુસ્તક બનાવી દેવામાં આવે, દ્રેક વિષયનું પુસ્તક બનાવીને લાયન્ટ્રેરીમાં મૂક્કવામાં આવે.

ડાયરી બનાવીને લખવી એ પણ એક અન્ય જાતનું જીવન રાખવાનું સાધન છે. ડાયરી રાખવી એ તો દ્રેક માટે સહેલો ઉપાય છે. ખાનગી ડાયરી એ વ્યકિતગત અનુભવો, વિચારો અને સારાંશ લખવા માટે ઉત્તમ સ્થળ છે.

જે માણસ ડાયરી રાખે છે તે માણસ તેને ડાયરી લખનાર અંગ્રેજીમાં ડાયરીસ્ટ કહેવામાં આવે છે. એક ડાયરી એ નોંધોની રીતે ડાયરીમાં માણસની વ્યકિતગત બૌદ્ધિક મુસાફરીનો રેકૉર્ડ હોય છે. ડાયરીનો એક અન્ય અસરકારક ઉપયોગ એ પણ છે કે તેનાથી “સ્વપરિક્ષા” અને જવાબદારી ભાવ વધે છે. ડાયરી રાખવાથી માણસમાં પોતાની સફળતા અને નિષ્ઠિયતાનું નિરીક્ષણ કરીને પોતાની જાતને સુધારી શકાય છે. આ રીતે ડાયરીથી માણસનો બૌદ્ધિક વિકાસ થાય છે.

(૯) જીવન ખાતર જીવન

પયગમબારે ઈસ્લામ(૩)એ ફરમાવ્યું “જીવને પારણાથી કબર સુધી મેળવતા રહો.” (સંદર્ભ ગ્રંથ તારીકે ઈરબલ વોલ્યુમ (૧) પેજ ૭). આપણને આ હદ્દીસથી જાણવા મળે છે કે જીવન એ થોડા સમયનો લાભ નથી પરંતુ એ કાયમી વાત છે જે જન્મથી લઈને મૃત્યુ સુધી ચાલતું

રહે છે. તેથી જ્ઞાન એ દરેક હાલતમાં ઈચ્છનીય છે જ. જ્ઞાનનો સાચો ઉપયોગ માણસનું જીવન ઘડતર છે. આ કોઈ થોડા સમયની વાત નથી. આ તો જીવનની ચાલતી પ્રક્રિયા છે. જે દરેક રિસ્થિતીમાં અને દરેક જગતાએ ચાલે છે. આ ઘડતરની પ્રક્રિયાનો કોઈ જ અંત નથી. તે અનંત છે. તેથી આ ક્રિયા મૃત્યુપર્યંત ચાલુ રહે છે. મગજ કયારેય રિસ્થિર-બંધીયાર થતું નથી. તેને જ્ઞાનના ખોરાકથી જીવંત રાખવું જોઈએ જેવી રીતે ખોરાક ખાવાથી શરીર જીવંત રહે છે. આ ખોરાક વિના શરીર નબળાઈ અનુભવે છે તે જ રીતે જ્ઞાનના ખોરાક વિના બૌદ્ધિક વિકાસ થતો જ નથી. આ રીતે બૌદ્ધિક વિકાસ વિનાના લોકોથી દુનિયામાં મહાન કામ થતું નથી.

૧૦. બીજા લાભકારી જ્ઞાન

પયગમભરે ઈસ્લામ (﴿)ની એક સુંદર મજાની દુઆ-પ્રાર્થના છે કે “ અય અહ્વાહ
મને નકામા જ્ઞાનથી બચાવજો” (અહ્વાહુમ્મા ઈન્ની અઉઝુબેક મીન ઈલ્હીન લાયદા) (સંદર્ભ
ગ્રંથ સહીએ મુસ્લીમ હફ્ટિસ નં. ૨૭૨૨). સાચું જ્ઞાન હોયતો તે માનવજાત માટે ફાયદાકારક હોય
છે. અન્ય તરફ જે જ્ઞાનથી માણસજાતને ફાયદો ન થાય તે જ્ઞાન નકામું છે ઈચ્છનીય નથી. આવું
નકામું જ્ઞાન મેળવવું એ સમયનો બગાડ જ છે.

૧૧. એક વિકસીત વ્યક્તિત્વ

કુરાનમાં ખુદા તાત્ત્વાલા સાચા માણસને એક છોડ તરીકે સરખાવે છે (કુરાન
૧૪/૨૪-૨૫) જેવી રીતે છોડ આગળ વધીને વૃક્ષ થઈ જાય છે એવી જ રીતે માણસનું
વ્યક્તિત્વ પણ વધીને લીલાછમ વૃક્ષ જેવું બની જાય છે. શારીરીક રીતે નાનું બાળક વધીને
શક્તિશાળી માણસ થઈ જાય છે. જો માણસની વિચારયાત્રા તંડુરસ્ત રહી તો આ માનવ મન
પણ આવા સુંદર મજાનો વિકાસ કરે છે જેવો વિકાસ શરીરે કર્યો.

આ ચિંતનક્રમ દરેક માણસમાં કુદરતી રીતે ચાલે જ છે. સૌ લોકો એ આ ચિંતનક્રમ
ખોરવાઈ ન જાય તે માટે ધ્યાન રાખવું જોઈએ. જરણા માંથી પાણી નીકળે છે તેવું જ
અવરોધાવિહીન વિચાર પણ નીકળે છે.

(૧૨) જેઓ વધુ જાણતા હોય તમને પૂછો

કુરાનમાં ખુદા તથાલા કહે છે “જો તમે ન જાણતા હો તો જાણકારોને પૂછો” (કુરાન ૧૬/૪૩). એટલેકે જો તમે જાણતા ન હો તો જે આ બાબતમાં જાણતું હોય તેને જ પૂછો. લોકોને બીજાને પુછવું ગમતું નથી. તે લોકો ને લાગે છે કે બીજાની સલાહ લેવી એ જાણે એવું છે કે બૌદ્ધિક લઘુતાની નિશાની છે. આ બહુજ ખરાબ ટેવ છે. સ્વસ્થ ટેવ એ છે કે એવું સમજવું કે બીજાને પુછવું એ એવું છે કે જેમ આપણે ડિક્ષનરી કે અન્સાયકલોપેડીયા માં જોઈએ છીએ. કોઈપણ માણસ સર્વાંગ સંપૂર્ણ હોતો જ નથી. તે પોતાની ખામીઓ શોધવા માટે પુસ્તકો વાંચે છે. આ જ રીતે, તેણે જે લોકો જીવનને વહેચાતા હોય તેમની સાથે પૂછવું અને સમજવાની ટેવ પાડવી જોઈએ. જે માણસ જીવાની છે જે જાણે છે તે એવો છે જાણે જીવંત બુક-પુસ્તક. જાણકારને પૂછવું એ એવું જ છે જાણે એક પુસ્તક વાંચવું. તેથી જીવનમાં તો વૃદ્ધિ થશેજ સાથે સાથે સબંધો પણ સુધરશે.

૧૩. ઈશ્વરીય ઈનામોમાં ચિંતન

પયગામબરે ઈસ્લામ (૩) એ ફરમાવ્યું છે કે “ઈશ્વરીય ઈનામોમાં-આશીર્વાદોમાં ચિંતન કરવું એ મહાન ઈબાદતનું કામ છે.” (સંદર્ભ ગ્રંથ: અલ અંજુમન, લેખક અબુ શૈખ અલ અસ્ખાહની હદિસ નં. ૪૩). ઈશ્વરીય ભેટો-આશીર્વાદોમાં ચિંતન કરવા જેવું કોઈ ઈબાદતનું કામ આ દુનિયામાં નથી. આનાથી વધુ મોટું ઈશ્વરની નજદિક કોઈ કામ નથી. આવા ચિંતનથી આપણાને વિવિધ ઈશ્વરીય વરદાન કહો કે આશીર્વાદ કહો જુદી જુદી દ્વારા દ્વારા કોઈ ચીજ માં જોવા મળશે. તેથી જ આ કામને ઈબાદત માટેનું ઉત્તમ કામ કહેવામાં આવે છે. આ ઈસ્લામી પરંપરામાં ઉત્તમ કામ કહેવામાં આવ્યું છે.

ઈશ્વરીય કૃપા (blessings) ની શોધથી પણ આપણે ઈશ્વરની નજદીક પહોંચી શકીએ છીએ. માનવ માટે આ ઈશ્વરની અનુભૂતિ નો સૌથી મોટો સ્ત્રોત છે.

૧૪. પ્રતિબિંબની પ્રક્રિયા

અબુદ્રદા પયગામ્બર સાહેબ (૩)ના ઉત્તમ સાથી હતા. અબુદ્રદાના મૃત્યુ પછી તેમની પત્રિને એક માણસે પુછયું (ઉમ્મે દરદાને) અબુદ્રદાનું સૌથી વધુ પ્રિય કામ કર્યું હતું? ઉમ્મે

દરદાએ કહ્યું “વિચારવું અને શીખવું” (સંદર્ભ ગ્રંથ: સુનન નિસાઈ હદિસ નં. ૧૧૮૫૦) આનાથી જાણવા મળે છે કે એક માનવી માટે ઉત્તમોત્તમ કાર્ય તેની આજુ બાજુ રહેલ પ્રકૃતિનું નિરીક્ષણ કરવું અને તેનાથી બોધપાઠ લેવો તે જ છે. આ કાર્ય એ બૌદ્ધિક અને આધ્યાત્મિક વિકાસ કરવાની (માનવમાં) પ્રક્રિયા છે જેનાથી માણસ ગંભીર સ્વરૂપમાં ચિંતન કરીને મૃત્યુ સુધી આ કામ ચાલુ રાખે છે.

૧૫. શિખવામાં નમ્રતા

હજરત અબ્દુલ્લા ઈન્ને મરઉદ નામના પયગમ્બર સાહેબ(ﷺ)ના એક સાથી કહે છે “જ્યારે તમે કંઈ જાણતા ન હો ત્યારે કહો કે ઈશ્વર બધું જ જાણે છે.” (સંદર્ભ ગ્રંથ: સહીઈ બુખારી હદિસ નં. ૪૮૨૨). આ સિદ્ધાંત ને શીખવામાં નમ્રતા કહી શકાય. વિકાસ માટે અતિ જરૂરી ગુણ છે. અરબ્સતાનમાં એક કહેવત છે “લા અદ્રી નીસ્કુલ ઈલમ” અર્થાત હુ જાણતો નથી એવું કહેવું એ અહિં ઈલમ-જ્ઞાન છે “એવું કહેવું કે હુ જાણતો નથી એ સામાન્ય વાત નથી. આનો અર્થ એ છે કે “તે પોતાના અજ્ઞાન વિષે જાણૂત છે” આવી વ્યક્તિમાં પુછપરછની જ્ઞાનના જાણૂત થાય છે. પરિજ્ઞામ તથા તે અંત મેળવવા સુધી લઈ જાય છે. જ્યારે માણસ કંઈ જાણતો ન હોય તો તેણે આ કબુલ કરી લેવું જોઈએ. જાણતો નથી એમ કહેવું પણ એટલુંજ અગત્યનું છે જેટલું કે “જાણવું”. આ વલશ વીજા માણસની આધ્યાત્મિક પ્રગતિ શક્ય જ નથી.

(૧૬) શિક્ષણ અને તાલીમ

પયગમ્બર સાહેબ(ﷺ)ના એક સાથી કહે છે કે “જ્યારે પણ એક પક્ષી આકાશમાં ઉડતું નજરે આવતું તો પયગમ્બર સાહેબ અમને જ્ઞાનના એક ભાગની યાદ અપાવતા”. (સંદર્ભ ગ્રંથ સહીઈ ઈન્ને હીજબન હદિસ નં. ૬૫).

આ પરંપરા આપણને બહુ ન્યાયી શિક્ષણ અને તાલીમનો જ્યાલ અપાવે છે. આ વાતથી જાણવા મળે છે કે ઔપચારિક શિક્ષણ મેળવવું એ જ શિક્ષણ નથી પરંતુ સ્કુલની બહાર પણ જ્ઞાનની ગંગા વહે છે તેનાથી અલિપત ન રહેવું જોઈએ. હકીકત એ છે કે દુનિયાના દરેક ઘરના માં જ્ઞાન છુપાયેલું જ છે. તે ઘરના નાની હોય કે મોટી. જો શિક્ષક સજાગ હોયતો સ્કુલની

બહાર દુનિયામાં પણ શિક્ષણનું અરણું વહાવી શકે છે અને તે રીતે બાળકોને પ્રબૃદ્ધ બનાવી શકે છે. આ જ રીતે એક નેતા પણ તેના અનુયાયીઓને માનસિક અને આધ્યાત્મિક તાલીમ આ જ સિદ્ધાંતો પર કુદરતી બનાવોમાં આપી શકે. આપણી આખી દુનિયા એ વિશ્વાળ શાળા છે. જે જ્ઞાન પિપાસું છે. તે તો દ્રેક જગ્યાએ, દ્રેક ક્ષણો, આંખો ખુલ્લી રાખીને જુએ તો જ્ઞાન મળી જ રહેશે. અને જ્ઞાન વધતું જ રહેશે. તેની વિદ્વતાપૂર્ણ સફર મૃત્યુ સુધી ચાલતી જ રહેશે.

(૧૭) જ્ઞાન અને ગંસીરતા

અભુલ્લા ઈજો અભાસ કહે છે કે “જે માણસ ઈશ્વરથી ડરે છે તે વિદ્વાન જ છે.” (સંદર્ભ ગ્રંથ સુનન અલ દારીમી હદ્દીસ નં. ૩૪૫). પયગમ્બર સાહેબ(ﷺ)ના વારિઝ સાથી બતાવે છે કે ગંસીરતા અને સાવચેતી એ અગત્યના પાસાઓ છે જ્ઞાન મેળવવાના. જ્ઞાન એ ફક્ત માહિતી મેળવવાનું જ નામ નથી. જ્યારે (સમજદાર) માણસ ઉંડું જ્ઞાન મેળવે છે તો તેના સુંદર પરિણામે તે ઈશ્વરની તરફ સચેત થઈ જાય છે. આ સાવચેતીથી મનુષ્યમાં ગંસીરતા પેદા થાય છે. જ્યારે જ્યારે મનુષ્યમાં ગંસીરતા વિહીન જ્ઞાન હોય છે ત્યારે સમજવું કે તેમને સાચી રીતે જ્ઞાન મળ્યું જ નથી.

સાચું જ્ઞાન ત્યારે જ કહેવાય જ્યારે માણસને નવો જ માણસ બનાવે. એક માણસ જે સાચું જ્ઞાન ધરાવે છે તે કુદરતી હકીકતોથી વાકેફ હોય છે. જે માણસ આ હકીકત જાણતો હોય તેને વિવાદોમાં રહેવું પરવડે નહિ. તેને બોલવામાં બેદરકારી પરવડે જ નહી. તે લોકોની વાતોને હળવાશથી નથી લેતો. સાચું જ્ઞાન માનવીને ગંસીર અને જવાબદાર દ્રેક અર્થમાં બનાવે છે.

(૧૮) જ્ઞાનમાં વૃદ્ધિ

કુરઆનમાં એક સરસ મજાની દુઆ છે કે “અય મારા પાલનહાર.. મારા જ્ઞાનની વૃદ્ધિ કર.” (કુરઆન ૨૦/૧૧૪). આ કુરઆની પ્રાર્થના આપણાને ઈસ્લામમાં જ્ઞાન મેળવવાની અગત્યતા બતાવે છે. ઈસ્લામના શિક્ષણ પ્રમાણે દ્રેક સત્રી-પુરુષે જ્ઞાન મેળવવા સતત પ્રયત્નશરીર રહેવું જોઈએ. અને તેમાં વૃદ્ધિ કરવા પ્રાર્થના એ નિશ્ચયનું જ બીજું નામ છે. પ્રાર્થનાની સંચાઈ

એ છે કે માણસ પોતાના ધ્યેયને પ્રાપ્ત કરવા મંડી પડે. તેણે ઈશ્વરને પ્રાર્થના કરવી જોઈએ કે તેના પ્રયત્નોને સફળતા આપે. આ રીતે પ્રાર્થના એક તેના જીવનનો અસ્તિત્વ અંગ બની જાય છે. જ્ઞાનની કોઈ સીમા નથી. માણસે (નવું નવું) જ્ઞાન મેળવવા સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ. જો કે જ્ઞાન અસીમ હોય છે. તેવી જ રીતે તેમાં સંદર્ભની પણ કોઈ જ સીમા નથી હોતી.

(૧૮) કોઈ જ બહાનું નહિં

પયગમખરે ઈસ્લામ(૩)એ એક વખત ફરમાવ્યું “માણસ બે વાતોથી હમેશાં છેતરાય છે. (૧) તંદુરસ્તી અને (૨) ફુરસદ” (સંદર્ભ ગ્રંથ: સહીહ બુખારી હદ્દિસ નં. ૬૪૧૨). તે એવું છે કે માણસ હમેશાં વિચારે છે કે તે કામ કરશે જ્યારે તંદુરસ્ત હશે કે ફુરસદમાં હશે ત્યારે. પરંતુ તંદુરસ્તી અને ફુરસદ હમેશાં છેતરામણી હોય છે. તેથી તે આ છેતરામણી રીતે જીવન ગાળે છે. અને એકાએક મૃત્યુ પામે છે. સમજદાર માણસ કયારેય બહાના શોધતો નથી. જ્યારે પણ કોઈ કામ મળે તે કામ સુંદર રીતે તુરત જ કરે છે. આ મિનીટ કરતાં કોઈ જ ઉત્તમ સમય નથી હોતો.

૨૦. અંતઃપ્રક્ષા માર્ગદર્શક બને છે.

પયગમખરે ઈસ્લામ(૩)એ એક વખત ફરમાવ્યું “ફતવો (અભિપ્રાય) તારા હિલને જ પુછને” (સંદર્ભ ગ્રંથ: મુસ્નાટ ઓહમદ હદ્દિસ નં. ૧૮૦૦૬). આ હદ્દિસ અંતર્જ્ઞાન ને બતાવે છે.

મનુષ્ય જીવનમાં અનેક સમસ્યાઓ વારંવાર આવે છે. માણસ દ્રેક સમયે ફતવા આપનાર મુફ્તી ને મળી શકે નહિં. જો મનુષ્યને માનસિક તકલીફો ન હોય તો તે પોતાનો જ માર્ગદર્શક બની શકે છે. આ આંતરસ્કુરણા એ હિલનો અવાજ હોય છે. ફક્ત શરત મનનું સાર્થ હોવું છે. તે દ્રેક જગ્યાએ હાજર જ હોય છે.

(૨૧) ડહાપણ

પયગમખર સાહેબ(૩)ના સાથી, ઉમર ઈબ્ને ખતાબ કહે છે કે “અસત્યને, મૌનથી ખતમ કરો” (હિલાયતુલ અવલીયા વોલ્યુમ (૧) પેજ ૫૫). આ કથન મૌનની શક્તિ બતાવે

છે. એક કહેવત છે કે તાલી બે હાથે જ પડી શકે છે. જો તમે જુહુણાને જુડ્ગાણાથી દૂર કરવાની કોશીખ કરો તો તેને વધુ ટેકો મળશે. આનાથી વિરુદ્ધ જો તમે મૌનથી જુઠ ને દૂર કરવા ચાહો તો જુઠ પોતાની મેળે જ નાશ પામશે. જો તમે બદલો લેવાની ભાવનાથી દૂર રહેશો તો કુદ્રત તમને સાથ આપશે. તે તમારું કાર્ય સુંદર રીતે કરાવશે તમારા કરતાં પણ સારી રીતે.

(૨૨) આશાવંત રહેવું

હસન અલ બશરી કહે છે કે “હિંમત એ ઈમાન (વિશ્વાસ)નો એક ભાગ છે” (સંદર્ભ ગ્રંથ: જામી બયાન અલ ઈલ્મ નં. દર્ર). આ એ કારણો કે ઈશ્વરમાં વિશ્વાસ, માણસને મહાન ભરોસો અપાવે છે. અને આ ભરોસાથી હિંમત મળે છે. પરંતુ આ દુનિયામાં ઘણા બધા અણગમતા સંજોગોનો સામનો કરવો પડેછે. જેનાથી તે હતાશાની ગર્તામાં પડી જાય છે. જો માણસ ઈશ્વરમાં વિશ્વાસ રાખતો હોય તો તે હિંમત નહિં હારે. જીવનના અંત સુધી નાહિંમત થશે જ નહિં. આ વિશ્વાસથી આત્મવિશ્વાસ પેદા થાય છે જે ગમે તેવી સ્થિતીનો સામનો કરે છે.

(૨૩) ટકાઉ કિયા

પયગાખરે ઈસ્લામ(૩)એ ફરમાવ્યું “ઈશ્વરને સૌથી ગમતું કાર્ય એ કામ છે જે હમેશા કરવામાં આવે.” (સંદર્ભ ગ્રંથ: સહીહ અલ બુખારી હફ્તિસ નં.૬૪૬૪) દુનિયામાં કોઈપણ કામ કરવામાં આવે, સાચી સફળતા મેળવવી હોય તો હમેશાં સમય થાય જ છે. જે કામ હમેશાં ધગશપૂર્વક કરવામાં આવે તેનાથી સફળતા મળે છે. દુનિયામાં પરિણામલક્ષી કાર્ય માટે સમય તો લાગે જ છે. જો આવું કાર્ય કુદરતના કાનુનો પ્રમાણેનું હોય તો. સાચું કાર્ય આ જ છે. કોઈ પણ કામ શરૂ કરતાં પહેલાં યોજના જરૂર કરવી જોઈએ. તેમણે સબંધિત બધાજ કામોની સમીક્ષા કરવી જોઈએ. સૌ પ્રથમ પોતાની ક્ષમતા જોઈને યોગ્ય આકારણી કરીને કયા સ્ત્રોતો મળી શકે છે તે જોવું જોઈએ અને તેવીજ રીતે સંજોગો પણ જરૂર ધ્યાનમાં રાખવા જોઈએ. આ બધા કાર્યો પછીજ દીર્ଘદ્વિંદી રાખીને લાંબો વિચાર કરીને જ કામ શરૂ કરવું જોઈએ. એકવખત કામ શરૂ કર્યું તો તેને અડધે રસ્તે કદીય છોડવું ન જોઈએ. સફળતા મેળવવાનો આ એકજ રસ્તો છે.

(૨૪) સમયનું ભાન રાખવું

પયગમબર સાહેબ(૩)ની પરંપરા આપણને માર્ગદર્શન કરે છે. તેમાં કહેવામાં આવ્યું છે કે “સમજદાર માણસ તે છે જે જીવની હોય” (સંદર્ભ ગ્રંથ: સહીહ ઈલ્લે હિન્દુભાન હદ્દિસ નં. ૩૬૧). આ હદ્દિસમાં કહેલ વાત આપ(૩)ની લાંબી પરંપરાનો એક ભાગ છે. તે માનવ જીવનની સંપૂર્ણતાનો અનુભવ કરાવે છે. ફક્ત બોલવામાં પ્રવિષ્ટા અને પુસ્તકીય જ્ઞાન અને ભૂતકાળની પરંપરાનું જ્ઞાન માત્ર પુરતું નથી. તેને સાંપ્રત સમય તથા ભૂતકાળનું જ્ઞાન પણ હોવું જોઈએ. તેને બન્ને જાતના જ્ઞાન હોવા જોઈએ. તર્કસંગત અને વ્યહવાર્દી જ્ઞાન હોવું જોઈએ. આ વિના તે સાર્વત્રિક એ સંદર્ભમાં વસ્તુઓને સમજવામાં નિષ્ફળ જાય છે. તેથી વાસ્તવિકતાનું ઊડાણપૂર્વક વિષ્ણેષણ શક્ય નથી. વ્યહવારિક દ્રષ્ટિએ કરે છે તે એક ખામીયુક્ત વ્યક્તિ કરે છે. તે સમયની સ્થિતીમાં શાશ્વત સત્યને કેવી રીતે લાગુ કરવું તે જાગ્રત્વામાં નિષ્ફળ જાય છે. આવી વ્યક્તિ સફળ થઈ શકતી નથી, તે નવી નવી યોજનાઓ (૪) કર્યા કરે છે.

(૨૫) હેતુમય જીવન

પયગમબરે ઈસ્લામ(૩)એ ફરમાવ્યું કે “ઈમાનત્વાળાની નિશાની એ છે કે તે નકામી વાતોને છોડી દે.” (સંદર્ભ ગ્રંથ: મુસનદે અછ્મદ હદ્દિસ નં. ૧૭૩૭) આ કથની બતાવે છે કે માનવીની જંદગી હેતુમય હોવી જોઈએ. ખરી વાત એ છે કે આ દુનિયામાં કરવાની અનેક વસ્તુઓ છે અને જંદગી બહુજ નાની છે. આવી સ્થિતીમાં આપણે માણસે બહુજ ધ્યાનપૂર્વક ચયનશીલ બનવું જોઈએ. તેણે તે જ બાબત કરવી જોઈએ જે આ જંદગીના હેતુને અનુસાર હોય. આ હેતુ સિવાયની અન્ય તમામ ચીજોથી દૂર રહેવું જોઈએ. તેની પાસે એટલું તો જ્ઞાન હોવું જોઈએ કે કઈ ચીજ કામની છે અને કઈ ચીજ નકામી છે. તેનામાં આટલી આવડત તો હોવીજ જોઈએ કે તે નકામી અને કામની ચીજોને જાણી શકે. સૌપ્રથમ તેણે લાભદાયક વાતોને પસંદ કરવી જોઈએ. નકામું કામ એ છે કે ફક્ત મજાક-આનંદ માટે કરવામાં આવે કે ટાઈમ પાસ કરવા માટે કરવામાં આવે. એક રીતે જો જોવામાં આવે તો થોડાક ટાઈમ પૂરતું મનોરંજન એ એક જાતની વિલાસીતા જ છે. જે માનવી હેતુમય જીવન પસંદ કરે છે તે આમાં ફસાતો નથી.

(૨૬) લાભનો સિધ્યાંત

ખુદા તથાલા કહે છે કે “આ દુનિયા નફાકારકતાના સિધ્યાંત પર બની છે.” (સંદર્ભ ગંથ કુરાઅન ૧૩/૧૭). જે વ્યક્તિ અન્યો ને લાભ આપશે તે લોકો પાસેથી પણ લાભ મેળવશે. આ સિધ્યાંત પ્રમાણે જ્યારે જ્યારે મનુષ્યને લાભ ન થાય ત્યારે તેણે વિચારણું જોઈએ કે તે બીજાઓ માટે લાભકારક બન્યો નથી તેથીજ આવું થયું છે. તેણે બીજાઓને વંચિત રાખ્યા તેથી તેને પણ વંચિતતાનો સામનો કરવો પડયો. જો તેણે બીજાઓને આપું હોત તો તેને જરૂર પાછું મળતે !

આ નફાનો સિધ્યાંત સમગ્ર જીવન સુધી ચાલે છે. તેમાં કૌટુંબિક અને સામાજિક વાતો પણ સામેલ હોય છે જ. આ સિધ્યાંત પ્રમાણે, ફરીયાદો અને વિરોધનો કોઈજ અર્થ નથી. આ દુનિયામાં દરેક ફરિયાદ અને વિરોધ વ્યહવારિક રીતે વ્યક્તિની ખામીઓ ના લીધી જ હોય છે. માણસે ફરિયાદ અને વિરોધ કરવામાં સમય બરબાદ ન કરવો જોઈએ. એના બદલે તેણે પોતાનું સ્વપરિક્ષણ કરીને વહેલી તકે પોતાની સુધારણા કરવી જોઈએ. આ દરેક સમસ્યાનો ઉકેલ છે.

(૨૭) મૌનમાં સફળતા

પયગમભરે દીસ્લામ(૧) એ ફરમાવ્યું “જે ચૂપ રહ્યો તે બચી ગયો.” (સંદર્ભ ગંથ મુસ્નદે એહમદ હદીસ નં. ૬૪૮૧). આ નિવેદન બતાવે છે કે જેમ બોલવું અગત્યનું છે તેવુંજ મૌન પણ મહત્વનું કાર્ય છે. જેવી રીતે પગલા લેવા એ કાર્ય છે તો એ જ રીતે કાંઈ ન કરવું પણ એક જાતનું કામ જ છે. જેવી રીતે આગળ વધવું એ કાર્ય છે તેવીજ રીતે (યોગ્ય સમયે) પાછળ હોવું (પીછે હઠ) પણ સમજદારી છે. જેવી રીતે આગળ વધવું એ કામ છે તેવીજ રીતે પીછે હઠ પણ કાર્ય છે જ. જેવી રીતે શક્તિની સ્થિતીમાં ફાયદો છે તેવીજ રીતે નમ્રતાની સ્થિતીમાં પણ ફાયદો જ છે. મૌનનો અર્થ એ નથી કે માત્ર ચૂપ રહેવું. તેને બદલે મૌન એ શાનદાર વ્યુહરચના છે. તેનું જ બીજું નામ મૌન આયોજન છે. શંકા વિનાની વાત છે કે, પ્રચારથી દુર શાંત રીતે કામ કરવું એ ઘોઘાટમય રાજકીય કાવાદાવાથી કયાંય ઉત્તમ છે. મૌન તેની સાથે કેટલાય ફાયદાઓ લાવે છે. જ્યારે માણસ મૌન હોય છે ત્યારે તે વિચારે છે અને તે બીજાઓથી શીખે છે. જ્યારે માણસ કોલાહલ વિહીન મૌન ધારણ કરે છે ત્યારે તે પોતાના આંતરમન ને જાગૃત કરે છે.

ક્યારેક બોલવું પણ જરૂરી હોય છે. પરંતુ એ જ સમયે માણસે ખામોશ રહેવાનો મહિમા પણ જાણવો એ ડહાપણ છે. ક્યારેક મૌન-શાંત રહેવાથી પરિસ્થિતી ખરાબ થવાથી બચાવે છે. નિરવ મૌન એ અઈચ્છનીય વાતોને અવગાણવાનું નામ છે. તે વાત શંકા રહિત છે કે અમુક વસ્તુઓને અવગાણવું એ ડહાપણભર્યું કામ (wise action) છે.

(૨૮) બે અલગ અલગ ગુણો

ખુદા તથાલા કુરઆનમાં કહે છે કે “દરેક માનવમાં બે અલગ અલગ ગુણો રહેલા છે. એક નફ્સે અમ્મારા અને બીજો નફ્સે લવ્યામા” (કુરઆન ૧૨/૫૩, ૭૫/૨)(મનેચા અને ઠપકો આપનાર મન). આ બન્ને ચીજો માનવ મનમાં કુદરતી રીતે જ જન્મજાત આવેલ હોય છે. નફ્સે અમ્મારા એટલે કે ego અથવા અહ્મ અને નફ્સે લવ્યામા એટલે પોતાનો અંતરાત્મા. આ બન્ને ગુણો શરૂઆતમાં સુખુપ્ત અવસ્થામાં રહ્યા હોય છે. જો તેમને જગાડવામાં ન આવે તો તેઓ એ જ નિષ્ઠિય સ્થિતીમાં જ રહે છે. જો કોઈ વસ્તુ તેઓને ઉશ્કેરે કોઈ માણસ વિરુદ્ધ, તો અહ્મ- ego જાણી જાય છે. તેનું પરિણામ એ સુખુપ્ત અજગરને જગાડવા જેટલું ખતરનાક હોય છે. બીજી બાજુ તેનાથી વિરુદ્ધ જો કોઈ માણસને નમતાપૂર્વક વર્તનથી જીતવામાં આવે તો જે પહેલા લોકો તેની પાસે કાંટાની આશા રાખતા હતા તેઓ (આ નમતાથી) આણી પાસે જ કુલો નો અનુભવ કરશે. તે હવે તેમના માટે દ્યાના નમૂનો બનશે.

(૨૯) સફળતા ધૈર્યથી મળે છે

પયગમ્બરે ઈસ્લામ(ﷺ) ફરમાવે છે કે “જાણી લો કે સફળતા ધીરજ રાખવાથી જ મળે છે.” (સંદર્ભ ગ્રંથ મુસ્નદે એહમદ હદીસ નં. ૨૮૦૩). ઉતાવળ એ ધૈર્યથી તદ્દન વિરોધી છે. ઉતાવળનું કાર્ય એ આયોજન-વિચાર વિનાનું હોય છે. અને ધૈર્ય એ આયોજનબદ્ધ હોય છે. જ્યારે એ જ કાર્ય સફળ થાય છે. સંપૂર્ણ આયોજન સાથે કરવામાં આવે તે આયોજન માંગે છે અને ખંતથી જ સફળતા મળે છે.

(૩૦) મુકાબલાથી દુર રહો

પયગમ્બરે ઈસ્લામ(ﷺ)એ ફરમાવ્યું “એ યોગ્ય નથી કે મોમિન પોતે જ પોતાની જાતને અપમાનીત કરે! તેમને પુછવામાં આવ્યું તે પોતાને શા માટે અપમાનિત કરે? તે

મુસીબતનો સામનો કરવા તૈયાર થઈ જાય કે જ્યારે તેની પાસે તેનો સામનો કરવાની તાકાત (જ) ન હોય.” (સંદર્ભ ગ્રંથ સુનન અલ તિરમીજી હદ્દીસ નં. ૨૨૫૪). પયગમ્બર સાહેબ(ﷺ)નું આ કથન આપણને સુંદર સિધ્યાંત આપે છે કે માણસનું કાર્ય હમેશાં ફળદાયી હોવું જોઈએ. જો તેની પાસે એવી શક્તિ ન હોય કે તે કોઈ મોટી તાકાતથી લડી શકે, અને જો તે લડે તો તેને અપમાનિત થવું પડશે. અને હાર મળશે. અને એવા કાર્ય માં જોડાવું યોગ્ય નથી જેનાથી પોતાનો જ વિનાશ થાય.

(૩૧) તમારાથી નીચાને જુઓ

પયગમ્બરે સાહેબ(ﷺ)એ તેમના અનુયાયીઓ ને આદેશ આપ્યો છે કે તેઓ તેમનાથી ઉચ્ચા ને ન જુઓ પરંતુ તેમનાથી નિઝનાને જુઓ, લૌટિક બાબતોમાં. આ રીતે તેઓ ઈશ્વરીય આશીર્વાદનું સન્માન જાળવી રાખશે. (સંદર્ભ ગ્રંથ સુનન અલ તિરમીજી હદ્દીસ નં. ૨૫૧૩). ઈશ્વરે આ દુનિયા જ એવી રીતે બનાવી છે કે તેમાં ઊચ્ચ-નીચ હોય જ છે. અમુક લોકો આગળ હોય છે અને અમુક લોકો પાછળ હોય ચે. આ સ્થિતીનો ફાયદો એ છે કે સ્પર્ધાનું વાતાવરણ હમેશા જળવાઈ રહે છે. આ પદકાર અને સ્પર્ધાના કારણે જ જીવનમાં પ્રગતિ અને વિકાસ થાય છે. આ જ કારણે કોઈ માણસ કોઈથી આગળ હોય છે અને કોઈ બીજાથી તે જ માણસ પાછળ હોય છે. માણસે હમેશાં લૌટિક રીતે નીચા માણસને જ જોવું જોઈએ. આનું પરિણામ એ આવશે કે માણસ કયારેય ઈશ્વરીય આશીર્વાદો જે ઈશ્વરે તેને આપેલા છે તેને યાદ રાખશે. તે ઈશ્વરનો આભારી થતો રહેશે. આનાથી વિરુદ્ધ જો તે તેના કરતાં લૌટિક રીતે ઉચ્ચ માણસને જોશે તો તેનામાં નફરત અને નારાજગી-રોષ જ વધશે. ફાયદો કોઈ નહિં થાય.

સકારાત્મક સ્વભાવ જાળવવાથી વ્યક્તિના માનસિક અને આધ્યાત્મિક વિકાસમાં ફળો મળે છે અને નકારાત્મક સ્વભાવ માનસિક અને તેના આધ્યાત્મિક વિકાસને અવરોધે છે.

(૩૨) ટાઈમ પાસ

કુરઆન કહે છે કે “સમય બતાવે છે કે માનવી નુકસાનમાં છે.” (કુરઆન ૧૦૩/૧-૨). કુરઆની આ આયત પ્રમાણે માનવની જીંદગી જાણે બરફ જેવી ક્ષણ ભંગુર છે. તે બરફની જેમ ઓગળતી રહે છે. સામાન્ય માણસની જીંદગી હું વર્ષ સમજો તો પણ જન્મ પછી તુરતજ

તેની છુંઢી જાણે ઓગળવા લાગે છે. માણસની ઉલટી ગણની જનમ્યા પછી તુરત જ ચાલુ થઈ જાય છે (countdown). જનમ્યાના પહેલા વર્ષ તે પછી વર્ષ જ બાકી રહ્યા હોય છે. તે જ રીતે બાકીના વર્ષો સમજો. આ રીતે દરેક માણસનું કાઉન્ટ ડાઉન- ઉલટી ગણની જનમ્યા પછી તુરત ચાલુ થતી જ રહે છે. કોઈપણ તેને રોકી શકતું જ નથી. આવી સ્થિતીમાં દરેક માણસે પોતાની એક એક મિનીટ નું ધ્યાન રાખવું જોઈએ કે તે કેવી રીતે ખર્ચાય છે. કારણકે ગયેલો સમય ક્યારેય-ગમે તેટલા રૂપીયા આપો પાછો આવતો જ નથી. જેવી રીતે ભૂતકાળ પણ પાછો આવતો નથી તેવી જ રીતે આ સમય પણ પાછો આવતો નથી તેથી તેને ગપસપમાં પસાર ન કરવો જોઈએ.

(૩૩) નિરાશા કદીય નહીં

ખુદા તચાલા ફરમાવે છે કે “અય મારા બંદાઓ, ઈશ્વરની(મારી) દ્યાથી કદીય નિરાશ ન થતા તે દ્યા ઘણી જ છે.” (કુરાન ૩૮/૫૩).

જ્યારે પણ માણસ નિરાશ થાય છે ત્યારે તે તેની માત્ર શક્યતાઓ જ જુએ છે, વિચારે છે. તે ક્યારેય નિરાશ ન થાય, જો તે ઈશ્વરીય દસ્તિથી તેની આંખો ઈશ્વરીય શક્યતાઓને જુએ.

માનવીય શક્યતાઓની એક હદ હોય છે. પરંતુ ઈશ્વરીય શક્યતાઓની કોઈ હદ હોતી નથી. જો માણસને આ વાતની જાગ્રા થઈ જાય તો તે ક્યારેય નિરાશ ન થાય. જ્યારે માણસને લાગે છે કે તેની હદ આવી ગઈ છે, ત્યારે તેના માટે અન્ય શક્યતાઓ હોય છે. જેની કોઈ જ હદ નથી હોતી. અને ત્યાં કોઈ જ અવરોધો નથી હોતા. સાચી વાત એ છે કે ઈશ્વરે માણસને આશાઓનો ખજાનો અર્પણ કરેલ છે કે તે ક્યારેય આશાથી ખાલી થતો નથી. તેને ક્યારેય એવું લાગતું નથી કે તેના માટે ઈશ્વરમાં વિશ્વાસ અને નિરાશા આ બન્ને સાથે સાથે જઈ (જ) ન શકે.

(૩૪) ઉચ્ચતમ નૈતિકતા

એક વખત પયગમ્બર સાહેબ(ﷺ)એ તેમના સાથીઓને કહ્યું “શું હું તમને ઉચ્ચ નૈતિકતાના ધોરણ ન બતાવું?” આપના સાથીઓએ કહ્યું “જરૂર બતાવો.” ત્યારે પયગમ્બર સાહેબ(ﷺ)એ ફરમાવ્યું “જે લોકો તમારી સાથે સંબંધો તોડે તેની સાથે તમે સંબંધો જોડો. જે

તમને ન આપે તેને તમે આપો. જે લોકો તમારી સાથે ખોડું કરે તમને માઝી આપો.” (સંદર્ભ ગ્રંથ અલ મુજબઅલ અવાત હદ્દીસ નં. ૫૦૬૪) To put it briefly, this is not a high ethical standard. પરંતુ ઉચ્ચ નૈતિકતા હમેશાં સિધ્યાંતો ઉપર જ રહેલી છે. તે બીજાઓના કામોના જવાબમાં નથી હોતી એ તો સિધ્યાંતો પર આધારીત હોય છે.

ઉચ્ચ નૈતિકતા એ છે કે જે બીજાની વર્તણુકથી પરે હોય છે. અને એકપક્ષીય રીતે સુંદર નૈતિકતાનો વળગી રહે છે. તેણે પોતાની જાતને માનસિક પ્રત્યાઘાતથી બચાવવી જોઈએ. મહાનતમ ચારિન્ય સબંધી, ઉચ્ચ નૈતિકતા એ છે કે એક માણસ હકારાત્મક વર્તણુંક ચાલુ જ રાખે, ભલે અન્યો નકારાત્મક વર્તણુંક કરે (છે ને મોટી વાત !!).

(૩૫) નિઃસ્વાર્થતા

કુરાન શરીફમાં “શાંત અંતરાત્મા” શબ્દ ઉમદા વ્યક્તિત્વ બતાવવા માટે વાપરવામાં આવ્યો છે (૨૭/૩૦). શાંત અંતરાત્મા, બીજા શર્જદોમાં કહીએ તો એ છે જે માનસિક જટીલતા રહિત હોય. જે કોઈ નકારાત્મક લાગણીઓથી મુક્ત હોય અને ઉપરી ભાવનાત્મક લાગણીઓથી આ દુનિયામાં દૂર હોય. માનવ વિવિધ સ્થિતીઓમાં જવે છે. રહે છે. આ સ્થિતીઓના લીધે નકારાત્મક લાગણીઓ પયદા થાય છે. દાખલા તરીકે નફરત, ઈર્ષા, ભૂતકાળની ઘટનાથી પયદા થયેલ દુર્ભાવ, બદલાની ભાવના, સ્વાર્થતા, સ્વરૂપાત્મકાંક્ષા, બીન સ્વીકૃતિ વગેરે. જે કોઈ આ બધી ભાવનાઓથી ઉપર ઉઠે તો તેને જ “શાંત અંતરાત્મા” કહી શકાય. આ સભાનતાપૂર્વક કરવામાં આવેલ process પ્રક્રિયા છે. કોઈપણ માણસ આ જગ્યાએ પોતાની જાતે જ પહોંચી શકતો જ નથી. આ જગ્યાએ પહોંચવા માટે પોતે પોતાના જ વાલી બનવું પડે છે અને પોતાને સતત સ્વર્ણ કરવા માટે લાગી રહેવું પડે છે. આ જ રીતે મનુષ્ય “શાંત અંતરાત્મા” બની શકે છે.

(૩૬) દુષ્ટતા ઉન્મુક્તન

ખુદા તથાલા કહે છે કે “સારા કામો સુકૃત્યો, દુષ્ટતાનો નાશ કરે છે.” (કુરાન ૧૧/૧૧૪) એટલે કે જો તમારાથી કોઈ ખરાબ કામ થઈ જાય તો તેના સારા કામથી દૂર કરો. ઉદાહરણ તથા જો કોઈ તમને દુષ્ટ કહે તો તે તમે તેના બદલામાં તમે કોઈ સારું કામ કરો. જો

તમે કોઈનું દિલ દુખાવ્યું હોય તો માફી માંગી લો. જો તમે કોઈ પ્રત્યે અભિમાન બતાવ્યું હોય તો, તેની પણે નમી લો. જો કોઈને તમે સદ્ગ્રાવ ન બતાવ્યો હોય તો હવે સદ્ગ્રાવ બતાવીને તેનું દિલ જતી લો. જો તમે કોઈ પ્રત્યે તોછડાઈ દર્શાવી હોય તો, તેને માન આપીને મનાવી લો. આ બધીજ વર્તાણુકથી દુષ્ટતા દૂર થાય છે.

(૩૭) પાપ શું છે?

પયગમબરે ઈસ્લામ(ૢ૩)એ કહ્યું “પાપ એ છે જે તમારા મનમાં ખટકે અને તમને ગમે નહિં કે આ વાત બીજાને ખબર પડે.” (સંદર્ભ ગ્રંથ સહિહ મુસ્લિમ હદ્દીસ નં. ૨૫૫૭). આ વ્યાખ્યા પાપની એવી છે જે દરેક વ્યક્તિની સમજ માં આવી જાય. દરેક માણસ પણે અંતરાત્મા છે જ. આ અંતરાત્મા એટલો બધો નાજૂક છે કે તમે જરા પણ ખરાબ કામ કરો તે તમને ઉંઘે અથવા ચેતને. જો માણસ પોતાના અંતરાત્માની વાત સાંસણે તો કદીય ખરાબ કામ ન કરી શકે. તેવીજ રીતે માણસ કોઈ ખરાબ કામ કરે છે ત્યારે ખાનગીમાં જ કરે છે. તે સતત પ્રયત્ન કરે છે કે કોઈનેય ખબર ન પડે. જ્યારે પણ ખરાબ વિચાર આવે કે તુરંતજ વિચારો કે હું જે કામ કરવા જઈ રહ્યો છું તે ન કરું તો જ સારું.

(૩૮) પડોશીના હક્ક

પયગમબરે ઈસ્લામ(૩૩)એ કહ્યું “ઈશ્ર-ખુદાની કસમ! એ મૌભિન નથી, જેનો પડોશી તેની શરારતોથી સલામત ન હોય! (સંદર્ભ ગ્રંથ સહિહ મુસ્લિમ હદ્દીસ નં. ૪૬). કયાંય પણ માણસ હશે તે હમેશાં કોઈની સાથેજ હશે. તેઓ તેમના પડોશીઓ હશે. પડોશીનો હક્ક છે કે તેમને કોઈ જાતની તકલીફ ન પડે. અન્ય શબ્દોમાં કહીએ તો આ ઉપદેશનો અર્થ જ એ છે કે દરેક મનુષ્ય આ દુનિયામાં સુખ શાંતિથી રહે. તેણે બહુજ સાવચેતી રાખવી જોઈએ કે તેના પડોશીઓ ને કોઈ જ જાતની તકલીફ ન પડે. સારો માણસ એ છે કે તેનાથી આજુબાજુ વાળાઓને કોઈ જ ફરીયાદ જ ન હોય. જો તમારા પડોશીઓ તમારાથી ફરીયાદ કરતા હોય તો તેનો અર્થ છે કે તમે તેમને તકલીફ આપી રહ્યા છો. તેથી તમારે આવું કામ કરવું બંધ કરવું જોઈએ. તમારે તકલીફ ન આપવી જોઈએ.

(૭૮) યુવાનો માટે સંવેદના અને વૃદ્ધ માટે માન

પયગમબરે ઈસ્લામ(૩૫)એ કહું છે કે “જે યુવાનો માટે સંવેદના ન રાખે અને વૃદ્ધો માટે માન ન આપે તે અમારામંથી નથી.” (સંદર્ભ ગ્રંથ મુસનાએ એહમદ હદીસ નં.૭૦૭૩). આ હદીસ આપણને બતાવે છે કે સમાજમાં વયોવૃદ્ધ માણસોને માન આપવું જોઈએ. એ સારા સમાજની નિશાની છે. ઉદાહરણ તથા સ્કુલ કે કોલેજમાં અધ્યાપકનું માન વધુ જ હોય છે. વિધ્યાર્થી કરતાં આપણે આપણા સમાજમાં મધ્યમ માર્ગ થી કઈ રીતે રહી શકીએ ભલા? બહુજ સાદો ઉપાય છે કે વૃદ્ધ યુવાનને સંવેદનાથી નવાજે અને યુવાન વૃદ્ધને માન અને તેમને લાયક ગૌરવ અર્પિત કરીને માન આપે. જે સમાજમાં લોકો આ બન્ને ગુણો પોતાના જીવનમાં અપનાવે તો તે સુખી સમાજ થઈ જાય અને એક બીજા માટે સુંદર અભિપ્રાયવાળો સમાજ બની જાય.

(૪૦) કરારની પરિપૂર્ણતા

ખુદા તથાલાનું ફરમાન છે કે “તેની સાથે કરાયેલ કરાર પરિપૂર્ણ કરો.” (કુરાઓ ૨/૪૦). આપણને ખુદા સમક્ષ આ કરાર માટે જવાબદાર ઠેરવામાં આવશે.

આ બતાવે છે કે આ કરાર બે માનવ વચ્ચેનો જ કરાર નથી પરંતુ તે ઈશ્વરીય કરાર છે તેથી તેના વિષે પુછવામાં આવશે. ખુદા પણ ત્રીજી પાર્ટી તરીકે અહી છે જ.

કરાર કોઈપણ હોય તેની અગત્યતા બહુજ હોય છે. પછી કરાર કરનાર ગમે તે હોય તેણે તે કરાર પૂરો જ જોઈએ. કરાર કરવો એ ગુનાહ નથી પરંતુ કરારનું પાલન ન કરવું એ ગુનો છે. એક નાનકડો કરાર તોડવો એ બધાજ માનવ કરારો તોડવા સમાન છે. શા માટે એક કરાર તોડવો બધાજ કરારો તોડવા બરાબર છે? કરણકે સામાજિક ન્યાયની પ્રક્રિયા તેના પર આધારીત છે કે કરારને આપણે કેટલું મહત્વ આપીએ છીએ. જો કરાર પ્રત્યેનું માન ગુમાવી દઈશું તો, સામાજિક ન્યાયનું વાતાવરણ નો જ અંત આવી જશે.

(૪૧) ભલાઈનો બદલો

પયગમબરે ઈસ્લામએ ફરમાવ્યું કે “કોઈ તમારા માટે સારું કામ કરે તો તમે પણ તેમને આવોજ સારો બદલો આપતા રહો. અને જો તેવોજ બદલો ન આપી શકો તો ઈશ્વરને તેના માટે પ્રાર્થના કરો.” (સંદર્ભ ગ્રંથ સુનન અભુ દાઉદ હદીસ નં. ૫૧.૬).

આ એક સંઘર્ષથીય વર્તણુંક છે કે કોઈ માણસ તમારા માટે સારું કામ કરે તો તમે પણ તેના પ્રત્યે સારું જ કામ કરો. જો તમે આવું જ સારું કામ કરવા અશક્ત હો તો તેના માટે કમ સે કમ પ્રાર્થના-દુઓ તો જરૂર જ કરો.

(૪૨) અન્યની તકલીફથી ખુશ ન થતા

પયગમબરે ઈસ્લામ(ﷺ)એ ફરમાવ્યું કે “તમારા લાઈની મુસીબત જોઈને ખુશ ન થાઓ. અન્યથા ઈશ્વર તેની મુસીબત દુર કરી દેશો પરંતુ તમને તે જ મુસીબતમાં ગ્રસ્ત કરી દેશો.” (સંદર્ભ ગ્રંથ સુનાન તિરમીજ હદ્દીસ નં. ૨૫૦૬).

આ હદ્દીસ લોકોને ખરાબ કામ કરાવતા અટકાવે છે. કારણકે આવું કરવાથી તેમનું ખુદ નું જ નુકશાન થઈ શકે છે. ઉલટાનું જેને તકલીફ પડેલ હોય તેના પ્રત્યે આપણાને સહાનુભૂતિ હોવી જોઈએ.

બને તો જે માણસને તકલીફ પડી હોય તેને મદદરૂપ થવું જોઈએ. અથવાતો કમ સે કમ તેના માટે પ્રાર્થના-દુઓ તો કરવી જ જોઈએ. તેનાથી વિપરીત અન્યના દુઃખમાં આનંદ લેવો એ જાણો પોતાને જ નિમ્ન કક્ષામાં લાવવા જેવી વાત છે. નિઃસંદેહ આ એક ખરાબ કક્ષાની વિકૃતિ છે.

બીજાની તકલીફમાં આનંદ મેળવવો એ ઈશ્વરને બહુજ અપ્રિય વાત છે. ઈશ્વરને આ વાત એટલી નાપસંદ છે કે તે જે માણસ આ વાતથી આનંદ મેળવે છે તેને જ આ વાતમાં ગ્રસ્ત કરે છે. અને પેલા વ્યક્તિને આ તકલીફથી મુક્તિ આપે છે. ખરેખર તો આ વાત ખરાબ માં ખરાબ કમનસીબીનું કારણ બને છે.

(૪૩) અન્ય માટે સારો અભિપ્રાય રાખવો

પયગમબરે ઈસ્લામ(ﷺ)એ ફરમાવ્યું કે “અન્ય માટે સારો અભિપ્રાય રાખવો એ ઈબાદત (worship) છે. આ એક મહાન કાર્ય છે જેને ઈબાદત (worship) કહેવામાં આવેલ છે.” (સંદર્ભ ગ્રંથ મુસનદે ઓહમદ હદ્દીસ નં. ૭૮૫૬). (હૃશેજન ઉર્દુમાં કહેવાય છે).

બીજા માટે સારો અભિપ્રાય રાખવો એ ઘણું જ અધરું કામ છે. જે લોકો સાથે સાથે રહેતા હોય છે તો તેમનો પરસ્પર સારો અભિપ્રાય રાખવો એ બહુજ અધરું કામ થઈ જાય છે. તેનું કારણ છે કે ખોટા અનુમાનો બીજાઓ માટે નકારાત્મક ધારણાઓના કારણે આવું બને છે. આવા સંજોગોમાં હકારાત્મક અભિપ્રાય હોવો એ મોટી વસ્તુ છે.

માત્ર તે વ્યક્તિ જ નકારાત્મક ધારણા વિના સકારાત્મક વિચારી શકે છે. અને નકારાત્મક પરિસ્થિતી હોવા છતાં ય હકારાત્મક રહી શકે છે.. જે ઉચ્ચ નૈતિક ગુણો ધરાવે છે તેવા લોકો જ ગલતફેહમી પેદા કરતા નથી પછી લલે ને ગમે તેવી ખરાબ વાત કોઈ માટે સાંભળે!!

(૪૪) આભારી બનો

પ્રયગમભરે ઈસ્લામ(ૢ૩)એ ફરમાવ્યું કે “જે માણસ અન્ય માણસનો આભાર નથી માનતો તે જાણે ઈશ્વરનો પણ આભારી નથી થતો.” (સંદર્ભ ગ્રંથ મુસ્નાહ એહમદ હદીસ નં. ૭૫૦૪). કોઈનો આભાર માનવો એટલે તેના ઉપકારનો સ્વિકાર કરવો. જો કોઈ પાસે આ ગુણ હોય તો સમજો કે તેણે ઈશ્વરનો પણ આભાર માની લીધો છે. એક માણસ બીજાનો આભારી નથી થઈ શકતો જ્યારે તે અન્યનો આભારી નથી હોતો.

કોઈની તરફેણનો સ્વિકાર કરવો એ ઉમદા માનવની નિશાની છે. અને આભારીપણાની લાગણી કહે છે. ઈશ્વરે દરેક માનવો ઉપર મહાન ઉપકારો કર્યા છે. તેથી દરેક માનવે તેનો સ્વિકાર કરવો જ રહ્યો ! આ આભારની લાગણી માનવ દૈનિક જીવનમાં કેટલો પરસ્પર આભાર પ્રગટ કરે છે તેનાથી ખબર પડે છે. જો આ આભારની લાગણી દૈનિક જીવનમાં પ્રગટ ન થતી હોય તો તે આ નિશાની છે કે તે ઈશ્વરીય આભાર પણ માનતો નથી તેવું સમજવામાં આવે ! ઈશ્વરીય આભાર તો માનવામાં આવે એવું એક માનવના દિલમાં કઈ રીતે રહી શકે ભલા !! કાં તો ઈશ્વર અને માનવ બન્ને પ્રત્યે આભાર હશે અથવાતો બન્ને પ્રત્યે આભારની લાગણી જ નહિં હોય !!

પયગમબરે ઈસ્લામ(૩)એ ફરમાયું છે કે “માનવ માત્ર ખરાબ કામ કરનાર (પાપી) છે અને ઉત્તમ પાપી તે છે જેને પોતાની ભૂલ માની લે !! (સંદર્ભ ગ્રંથ મુસ્નદે એહમદ હદીસ નં. ૧૩૦૪૮). આ હદીસ પયગમબર સાહેબના કથનમાં કહેવામાં આવ્યું છે કે જે ખોટું કરે છે તે ભૂલ તો છે જ પરંતુ જે પોતાની ભૂલ કબુલ નથી કરતો તે મોટી ભૂલ છે. પોતાની ભૂલ કબુલ કરવી એ નબળાઈની નિશાની નથી પરંતુ તે પુખ્તતાની નિશાની છે. અહી ની દુનિયા તો આપણી પરિક્ષા માટે જ બનાવવામાં આવી છે. આ દુનિયામાં રહીને માનવ ભૂલો ન કરે તો જ નવાઈ! તેથી તે વારંવાર ભૂલો કરતો જ રહે છે. તેથી સાચા માણસની એ નિશાની નથી કે તે ભૂલો ન કરે પરંતુ તેના સાચા હોવા માટે એ પુરતું છે કે તે આવી ભૂલો વારંવાર ન કરે. પરંતુ ભૂલ કર્યા પછી તેના દિલ માં ઊંખ લાગે- મનમાં ખરાબ લાગે. શરમીદા થાય અને જાગૃત થઈ જાય. સાચી ભૂલ અને કહેવાય જેનાથી તેનો અંતરાત્મા જાગૃત થાય અને પોતાની જવાબદારીનું જ્ઞાન થાય !!

(૪૬) અંતરાત્માનો અવાજ

એક વખત આપ(૩)ના સાથીઓ એ પ્રશ્ન કર્યા કે સારું શું છે અને ખરાબ શું છે? પયગમબર સાહેબએ ફરમાયું “તું તારા અંતરાત્માને જ પુછને! તેનો જ ફતવો (openion) લે ને !” (સંદર્ભ ગ્રંથ મુસ્નદે એહમદ હદીસ નં. ૧૮૦૦૬). આનો સીધો સાદો અર્થ એ જ છે કે આ બાબત બીજા કોઈનો ફતવો (અભિપ્રાય) લેવાની જરૂર જ નથી. તું પોતે તારો જ અભિપ્રાય લઈ લે ને!! સારું કામ એ છે જે તારા દિલને ખુશી પહોંચાડે અને ખરાબ કામ એ છે જે દિલને દુઃખ પહોંચાડે!! દરેક માણસમાં તેનો અંતરાત્મા બેસેલો જ હોય છે. આ અંતરાત્મા એ જાણે એક ન્યાયાલય જ છે. અંતરાત્મા તૂરંત જ કહી દે છે કે શું ભલું છે અને શું બુરું છે. અન્ય શર્ષ્ટોમાં કહીએ તો કઈ વર્તણુંક સારી છે અને કઈ વર્તણુંક ખરાબ છે તે અંતરાત્મા કહીજ દે છે. જો માનવ સાચા દિલથી પોતાના દિલની વાત માને તો પણ તે તેના માટે પૂરતો ગાઈડ છે. (પરંતુ તેનો અંતરાત્મા ગુનાઓથી અતિ લિપ્ત થયેલ હોય તો તેને કોઈ જ ની અસર થતી જ નથી).

આપણો અંતરાત્મા તો આપણને ઉંબે જ છે, કે સારું શું છે અને ખરાબ શું છે? તે માનવ પોતાના સ્વ પ્રત્યે બેદ્ધકાર ન હોય તો તેના માટે તેનો અંતરાત્મા સત્યનો રસ્તો બતાવવા માટે પૂરતો છે જ !!

(૪૭) ટ્રસ્ટ પાછો આપો-(અમાનતો અમાનતદારોને પાછી આપો)

કુરાન શરીફમાં ખુદા તાત્ત્વાલા ફરમાવે છે કે “અય લોકો ! ટ્રસ્ટ ટ્રસ્ટીને પાણું આપો.” (કુરાન ૪/૫૮). એટલેકે “અમાનતો અમાનતદારોને પાછી આપો.” આ કુરાનમાં રબ તાત્ત્વાલાનો હુકમ સમગ્ર જીવનને લાગુ પડે છે.

અમાનતનું એક સ્વરૂપ એ છે કે કોઈની પાસે અમાનત તરીકે બીજા કોઈની મિલકત હોયથો તેના માલીકને પહોંચાડવી એ તેના માટે ફરજ છે. આ જ રીતે સ્કુલમાં શિક્ષક પણ એક અમાનતદાર જ છે. તેવીજ રીતે વિધ્યાર્થી પણ એક અમાનતદાર જ છે. શિક્ષકે પોતાની જીવાબદારી સમજને વિધ્યાર્થીએ મુકેલ વિશ્વાસનું જતન કરવું જોઈએ. એવીજ રીતે એક માણસ શાસક બને છે તો તે પણ અમાનત (trust) તરીકે જ આવે છે, કારણ આખો દેશ તેના અમાનતમાં છે. તેથી શાસકે દેશનું શાસન એ રીતે કરવું જોઈએ કે લોકોની અપેક્ષાઓ પુરી થાય.

(૪૮) શાંતિની સંસ્કૃતિ

ઈસ્લામનું શિક્ષણ એ છે કે જ્યારે કોઈની પણ મુલાકાત થાય બન્ને એક બીજાનું અભિવાદન કરે. (સંદર્ભ ગ્રંથ સુનન અનનિસાઈ હદીસ નં. ૧૦૦૭૮) એટલે જ કહેવામાં આવે છે “સલામતિ હજો તમારા ઉપર”. ઈસ્લામ શાંતિની સંસ્કૃતિ છે, અને એવું કહેવું કે “તમારા ઉપર શાંતિ હજો.” એ શાંતિની સંસ્કૃતિ છે.

ઈસ્લામનું શિક્ષણ એ છે કે તમામ લોકો માટે દ્યાખાવ અને સહાનૂભૂતિ હોવી જોઈએ. આ બધું સાચા દ્વિલથી હોવું જોઈએ. દરેક, માનવ માટે શાંતિમય જીવન અને સલામત જીવન ઈચ્છે છે. આ જ તો ઈસ્લામના પાયાના સિધ્યાંતો છે. ઈસ્લામનું દરેક શિક્ષણ સીધું અથવા પરોક્ષ રીતે શાંતિના જ સિધ્યાંતને વરેલું છે. શાંતિ વિના કોઈજ મોટું કામ થઈ જ શકતું નથી. જો શાંતિ નહી હોય તો વિકાસ પણ નહી હોય. શાંતિ એ વિકાસ માટે નું એક મહત્વનું પરિબળ છે. જેવું કે પાણી એ જમીનની ફળદૂપતા માટે અગત્યનું છે !!

(૪૯) શાંતિવાદ

પયગમબરે ઈસ્લામ(૩૩)એ એક વખત ચેતવણી આપતાં ફરમાવ્યું કે “દુશ્મન સાથે પણ ટક્કરની તમના ન કરો. પરંતુ ઈશ્વરથી માઝીની ઈચ્છા કરો.” (સંદર્ભ ગ્રંથ સહીહ અલ બુખારી હદીસ નં. ૨૮૬૬). આ પરંપરા પાયાના સિધ્યાંતો માનો એક સિધ્યાંત છે જે વ્યક્તિગત અને રાજ્ય માટે પણ એટલું જ ઉપયોગી છે. માનવી સામાજિક જીવન જીવે છે ત્યારે સ્વાભાવિક પણે મતસેદો તો ઉસા હોય જ છે. આ મતસેદોના લિધે મુકાબલાની સ્થિતી ઉસી થાય છે. પરંતુ એ યોગ્ય નથી કે તેના લિધે બીજાને દુશ્મન માનવામાં આવે અને લડાઈ શરૂ કરી દેવામાં આવે. સાચો રસ્તો એ છે કે શાંતિપૂર્ણ સૌહાર્દ જાળવી રાખવામાં આવે અને કોઈપણ ભોગે મુકાબલો દુર્ભ કરવામાં આવે.

શાંતિપૂર્ણ રસ્તો હર હાલમાં જાળવવામાં આવે. એક વસ્તુની સખત જરૂર હોય છે કે માણસે નકારાત્મક માનસિકતા ત્યજવી જોઈએ, લલે ને ગમે તેવા ખરાબ સંજોગો કેમ ન હોય!

(૫૦) શાંતિપૂર્ણ નાગરિક

પયગમબરે ઈસ્લામ(૩૩)એ કહ્યું છે કે “મુસ્લિમ તે છે જેના હાથ અને જીબથી લોકો સલામત રહે.” (સંદર્ભ ગ્રંથ મુસ્નાફ એહમદ હદીસ નં. ૮૮૩૧). આનો અર્થ એ થયો કે ઈશ્વરનો સાચો દાસ એ છે જે અહિસક માણસ તરીકે સમાજ માં રહે છે. તેણે એવા શબ્દો પણ ન બોલવા જોઈએ જેનાથી અન્યોની લાગણીઓ દુખાય! એટલે તેનાથી કોઈનું ય દિલ દુખાવાય જ નહિ. આ નિમ્નતામ માનવતાનું ધોરણ છે. ઉચ્ચતમ સામાજિક સ્તર, સ્ત્રી-પુરુષો માટે એ છે કે જે સમાજમાં રહીએ છીએ તેમાં એકબીજાને લાભાન્વિત કરાય. અને જો કોઈ લાલ ન આપી શકાય તો કમ સે કમ કોઈના ય માટે પ્રશ્નો તો ન જ ઉસા કરાય.

જ્યારે એક માણસ અન્યને શબ્દો અથવા હાથથી નુકશાન પહોંચાડે છે તો તેનું માનવતાના સ્તરથી પતન થઈને જાનવરની કષાએ પહોંચી જાય છે. ખરેખર તો માનવતાનું ઉચ્ચ સ્તર એ છે કે માણસ એટલો સહફયી હોવો જોઈએ કે તે કોઈને ય નુકશાન ન પહોંચાડી શકે.

જો માણસ આ બાબત સંવેદનશીલ હશે તો તેને કોઈને ય તકલીફ પહોંચાડવાનું નહિ જ ગમે. જો કયારેક પણ કોઈને તેના થકી નુકશાન પહોંચાડાઈ ગયું તો વિચારશે કે મારાથી માણસાઈના સ્તરની નીચેનું કામ થઈ ગયું અને તે તે નુકશાન ભરપાઈ કરવાની ભરપૂર કોશિશ કરશે અથવા માફી માંગી લેશે.

(૫૧) કોઈને ય નુકશાન ન પહોંચાડો

પયગમભરે ઈસ્લામ(૩) એ ફરમાવ્યું કે “ન તમે બીજાને નુકશાન પહોંચાડો અને ન તો તમને નુકશાન પહોંચો.” (સંદર્ભ ગ્રંથ મુસ્નાહ એહમદ હદીસ નં. ૨૮૫). પયગમભર સાહેબની આ પરંપરા એક મહત્વપૂર્ણ સામુહિક સિધ્ધાંત વર્ણિત છે. આ સિધ્ધાંત પુરુષ-સ્ત્રી અને તમામ સામાજિક લોકોને વ્યક્તિગત રીતે લાગુ પડે છે અને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય જીંદગીમાં પણ સંપૂર્ણ તથા લાગુ પડે છે જ.

સાંપ્રત સમયમાં દરેક માણસને ઈચ્છનીય અને અનઈચ્છનીય સંજોગોથી ઝુજવાનું આવે છે. કારણ દરેક વિવિધ સ્થિતીઓમાં રહે છે. એક બહુ વ્યાપી નિયમ છે કે સ્ત્રી-પુરુષો એ કઈ રીતે આવી સ્થિતીમાં રહેવાનું છે. પહેલો નિયમ એ છે દરેક સ્ત્રી-પુરુષ બીજા માટે નુકશાન રહિત રહેવાનું છે. અને બીજો નિયમ એ છે કે એવી સુંદર રીતે રહેવાનું છે કે અન્ય કોઈને ય નુકશાન ન પહોંચે.

(૫૨) મહાન શક્તિ

પયગમભરે ઈસ્લામ(૩) ફરમાવે છે કે “ઈશ્વર જે કાઈ નમૃતાથી આપે છે તે કઠોરતાથી કોઈને આપતો જ નથી.” (સંદર્ભ ગ્રંથ સહીહ મુસ્લિમ હદીસ નં. ૨૫૮૩). આ શબ્દોમાં કુદરતનો નિયમ વર્ણવાયો છે. ઈશ્વરે આ દુનિયા જ એવી રીતે બનાવી છે કે તેમાં જે નમૃતાના રસ્તે મળે છે અને અહિસાથી જે મળે છે તે કઠોરતા અને હિંસાથી મળતું જ નથી. નમૃતા અને અહિસા સુંદર પરિણામો લાવે છે. જ્યારે કઠોરતા અને હિંસાથી કોઈ (સારા) પરિણામ આવતા જ નથી.

કઠોરતા અને હિંસાનું વલાશ અપનાવવાથી કદાચ ગુરુસો તો શાંત થઈ જાય પરંતુ તેનાથી કોઈ રચનાત્મક હેતુ સરતો નથી. રચનાત્મક કાર્ય માટે સતત કામ ચાલુ રહેવું જરૂરી છે. અને આવું ત્યારે જ શક્ય બને જ્યારે આ કામ અહિંસક રીતે કરવામાં આવે.

(૫૩) સમાધાન ઉત્તમ છે

ખુદા તથાલા કુરાઓન શરીરક્રમાં લોકોને ઉદ્ઘેશીને કહે છે “જઘડામાં સમાધાન ઉત્તમ છે મુકાબલા કરતાં કયાંય સારું છે.” (કુરાઓન ૪/૧૨૮). સમાન્યતઃ જીવનમાં ઝગડા તો થતા જ રહે છે. આવી સ્થિતીમાં બે જ રસ્તા છે. એક કે તેનો ઉકેલ મુકાબલાની ભાષામાં અને હિંસાથી લાવવામાં આવે અને બીજો ઉપાય છે સમાધાનનો. આ રીતે શરૂની સ્થિતીમાં જ જઘડાનો ઉકેલ લાવવામાં આવે.

ખરેખર તો સમાધાનની વૃત્તિથી બન્ને પક્ષોને લાભ મળે છે. જઘડાની રીતથી ઊલટું પરિણામ આવે છે. તેનાથી તો બન્ને પક્ષે નફરત વધે છે અને પ્રશ્ન જે હતો તે તો ત્યાંનો ત્યાં જ રહે છે. અને આ રીતે તો તે પ્રશ્નનો ઉકેલ કદીય આવતો જ નથી. જો માણસો જઘડાના પરિણામની દ્રષ્ટિએ વિચારે તો તેઓ કયારેય મુકાબલાની ભાષામાં વાત જ ન કરે. કારણકે તેથી તો વિનાશ સિવાય કાંઈ જ મેળવવાનું નથી હોતું.

(૫૪) સામાજિક સેવા

ખુદા તથાલા કુરાઓન શરીરક્રમાં ફરમાવે છે “અને તેમના ધનમાં માંગનારાઓ અને વંચિતોનો હિસ્સો હતો.” (કુરાઓન ૫૧/૧૮). બે જાતના ગરીબો હોય છે. એક તો જેઓ હમેશાં જલથી માંગતા જ રહે છે, અને બીજા પોતાની જરૂરીયાત કદીય કોઈને ય કહેતા જ નથી. તેથી આ બીજા લોકો ઉપર ધ્યાન દેવું જોઈએ. તેમની જરૂરીયાતો પૂરી કરવી જોઈએ. મોમિનો એ એવું ન સમજવું જોઈએ કે તેમની પોતાની કમાઈ ઉપર ફક્ત તેમનો જ હક્ક છે. તેઓ જવાબદાર માલિક ત્યારેજ બની શકે છે જ્યારે તેઓ આ સંપત્તિ યોગ્ય સુપાત્ર ગરીબોને આપીને આખેરત માટે જમા કરાવી આપે. આ ઈસ્લામિક શિક્ષાશ દ્વારા માનવ ને જવાબદાર

માણસ બજાવે છે અને પછી તે સમાજને આપે છે. તે સમજે છે કે તેણે સમાજ પાસેથી જે લીધિલ છે તે સમાજને જ પાછું આપવું જોઈએ તે તેની ડયુટી (duty) છે.

એક સિક્ષુક એ માણસ છે જે પૈસા અથવા ખાવાનું માંગે છે અને જવે છે. જ્યારે ખરેખરા વંચિતો એ છે જેઓ કોઈ કારણથી અપેંગ થઈ ગયા હોય છે. ઈસ્લામ પ્રમાણે વિકલાંગ લોકોની સેવા કરવી એ માત્ર સામાજિક સેવા જ નથી. પરંતુ તેવું કરવાથી ઈશ્વરની દ્યાના હક્કદાર પણ બનાય છે.

(૫૫) માનવ માત્ર એક સમાન

પયગમ્બરે ઈસ્લામ(ﷺ)એ ફરમાવ્યું કે “સાંભળો, દરેક માણસ આદમ અને ઈવ (હવા)ના સંતાનો છે અને આદમને માટી માંથી પયદા કરવામાં આવેલ હતા.” (સંદર્ભ ગંથ સુન ન અબુ દાઉદ હદીસ નં. ૫૧૧૬). આ હદીસથી સ્પષ્ટ જાણવા મળે છે કે દરેક માનવ ઈશ્વરની નજીક એક જેવાજ છે. બાબુ દેખાવમાં આપણને બિન્ન દેખાય પરંતુ સાચી રીતે તેમાં કોઈ જ અલગતા નથી. આ હદીસ મહત્વનો સિધ્યાંત બતાવે છે કે માનવો સંબંધની દૃષ્ટિએ સરખા જ છે. દરેક માનવ એક સરખા પદાર્થથી પયદા થયેલ છે. તેઓ એક જ સ્ત્રી પુરુષ ના વંશજો છે. આ રીતે તેમની વચ્ચેના બેદો પોતાની જાતે જ ઓગળી જાય છે! આ રીતે જોઈએ તો દરેક પુરુષો એક બીજાના ભાઈઓ છે અને દરેક સ્ત્રીઓ પરસ્પર બહેનો છે. આ સિધ્યાંત પ્રમાણે માનવીય બેદલાવોનો નાશ થઈ જાય છે.

(૫૬) પરામર્શનું મહત્વ-સલાહનું મહત્વ

કુરઆનમાં આપણને દરેક બાબત સલાહ-પરામર્શથી જ કામ કરવાનું કહેવામાં આવ્યું છે. (કુરઆન ૩/૧૫૮). આપણને પયગમ્બર સાહેબ(ﷺ)ની હદીસોથી જાણવા મળે છે કે ઈસ્લામ દરેક કામો પરસ્પર સલાહ લઈને જ કરવાનું કહે છે. આ સલાહ-પરામર્શ શું છે? આ સલાહ-પરામર્શ એ છે કે દરેક જાતના કામો પરસ્પર સલાહથી જ કરવા પછી ગમે તે વાત કેમ ન હોય? આ રીતે કરવાથી દરેક માણસનું જ્ઞાન અને અનુભવનો લાસ બધાને મળે છે. જેનાથી પ્રશ્નનો ઉકેલ લાવવામાં આસાની રહે છે, અને વધારે સારી રીતે કામ થાય છે. જો સલાહ વિના

કોઈ કામ કરવામા આવે તો તે ફક્ત એક જ માણસનો વિચાર હોય છે, અને જે સલાહથી કામ કરવામાં આવે છે તેમાં અનેક માણસોના અભિપ્રાયો હોય છે તેથી તે કામ સારું થાય છે.

સલાહ-મશવરો એ સામુહિક વિચાર કાર્ય હોય છે. વ્યક્તિત્વાત વિચારવું અને સામુહિક વિચારણા એ એવી જ છે જાણે કે વ્યક્તિત્વાત વિચારવું અને સામુહિક ચિંતન કરવું ઘણી વખત એવું બને છે કે એક વ્યક્તિત્વ અમુક વસ્તુમાં બરાબર વિચારી શકતો જ નથી. (consultation compensates for short coming). સલાહ-મશવરાથી વધુ સારી રીતે વિચારણા થઈ શકે છે, અને વધુ વાસ્તવદર્શી અભિપ્રાય મળે છે. તેથી આ બાબત ભવિષ્યમાં થનારી ભૂલો પણ અગાઉથી જ સુધારી શકાય છે. સલાહ એ આ રીતે બહુજ ઉમદા અંગ (planning) નું છે.

(૫૭) કોઈનાથીય ગ્રાણ દિવસથી વધુ અભોલા રાખી ન શકાય

પયગમબારે ઈસ્લામ (-Islam) એ કહ્યું છે કે “પોતાના સાઈથી ગ્રાણ દિવસથી વધુ અભોલા ન રાખી શકાય.” (સંદર્ભ ગ્રંથ સહીએ મુસ્લિમ હદીસ નં. ૨૫૬૦). આનો અર્થ એ થથો કે કોઈની સાથે ય, કોઈપણ કારણથી અભોલા રાખવાની વાત આવે તો તેની મુદ્દત વધુ માં વધુ ગ્રાણ દિવસ ની છે. ગ્રાણ દિવસથી વધુ કોઈથી ય બોલચાલ બંધ ન કરી શકાય. આ ગ્રાણ દિવસની મુદ્દત એટલા માટે આપવામાં આવી છે કે માનવીનો ગુરુસો ગ્રાણ દિવસમાં શાંત પડી શકે છે. ત્યાર પછી તો આ ગુરુસો અહેમ (ego) બની જાય છે. માણસને ગુરુસા માટે માફી મળી શકે છે પરંતુ અહેમ (ego) માટે માફી મળી શકતી નથી. ગુરુસો એ માનવ સહજ પ્રકૃતિવૃત નભળાઈ છે. થોડા સમય પૂરતી આવે છે. જ્યારે અહેમવાદ (egoism) એ બુરાઈ છે. અને એક જાતની બગાવત છે. તેથી જ ગુરુસાની માફી મળે છે પરંતુ અહેમને બગાવત માનવામાં આવી છે. માનવીને અસ્થાયી ગુરુસા માટે માફી મળી શકે છે, પરંતુ અહેમવાદ માટે અને અવજ્ઞાકારીતા ને ગુનો ગણવામાં આવ્યો છે. તેના માટે ઈશ્વર તરફથી કોઈ જ માફી આપવામાં નથી આવી.

(૫૮) સિવિકારવા પહેલાં બરાબર તપાસી લો

કુરાન શરીફમાં આપજાને તાકીદ કરવામાં આવી છે કે “જ્યારે પણ તમે કોઈ સમાચાર સાંભળો, કોઈનાય પાસેથી તો સૌપ્રથમ તે સમાચાર બરાબર તપાસી લો.” (કુરાન

૪૮/૬). આ આયત જીવની દરરોજ કામમાં આવતી વાત કહે છે. તે બતાવે છે જે કંઈ સાંભળીએ તે તુરત જ માની લેવું એ બેજવાબદાર ફૂત્ય છે.

સામાન્યત: લોકો દરેક વાત જે સાંભળે તે માની લે છે. આપણો અનુભવ ઘણી વખત બતાવે છે કે જે સમાચારો આપણો સાંભળીએ છીએ તે આખી વાત સાંભળ્યા વિના, તે જ્યારે આપણી પાસે આવે છે ત્યારે અપૂરતા હોય છે કે જેણસેળવાળા થઈને આપણાને મળે છે. અથવાતો તેનો સાર જે તેમાંથી કાઢવામાં આવ્યો હોય છે તે ખોટો હોય છે.

કોઈપણ સમાચાર સંશોધન વિના માની લેવામાં આવે તો મોટે ભાગે નુકશાન પહોંચાડે છે, અને ગેરસમજો પયદા કરતા હોય છે. લોકો એકબીજા વિશે ખોટા સમાચારો, ખોટા અસિપ્રાયો સાથે બનાવે છે અને તેનો પ્રસાર થાયતો ઘણું વધુ ઘર્ષણ પયદા થાય છે. આવી રિસ્થીમાં આપણી સૌની જવાબદારી થાય છે કે આપણે બરાબર નિરીક્ષણ કરીને જ સમાચારો આગળ ચલાવીએ. યોગ્ય ચકસણી કર્યા વિના કોઈપણ સમાચારને અધિકૃત માનવાની લૂલ ન કરીએ. (અત્યારના વોટશોપીયા જમાનામાં તો આ વાતની અગત્યતા અતિ વધી જાય છ).

(૫૮) દરેક માનવીએ આપણા ભાઈઓ જ છે

પયગમબરે ઈસ્લામ(૩) ફરમાવે છે કે “અય ઈશ્વર, હું સાક્ષી આપું છું કે દરેક માનવ માત્ર ભાઈઓ અને બહેનો છે.” (સંદર્ભ ગ્રંથ સુનન અબુ દાઉદ હદીસ નં. ૧૫૦૮). આ હદીસ માનવતા અને સંબંધોનો મૂળ સિદ્ધાંત બતાવે છે. આ હદીસ પ્રમાણે આખીય દુનિયા એક કુટુંબ જેવી જ છે. દરેક મનુષ્યે જેવી રીતે પોતાના કુટુંબ સાથે વર્તન કરે છે તેવું જ વર્તન સમગ્ર લોકો સાથે કરવું જોઈએ. દરેકને પોતાના લાઈ-બહેન જ સમજવા જોઈએ. આ જ વિશ્વ કુટુંબનો સિદ્ધાંત છે. આ સિદ્ધાંત જ ભાગલાને આપણે મને તેઓને દૂર કરે છે. આ જ સિદ્ધાંતથી સમગ્ર માનવજાત ને માનવતાની મજબૂત સંબંધોથી જોડે છે, અને વધુ મજબૂત બનાવે છે. આનાથી વધુ મજબૂત કોઈ સંબંધ નથી હોતો.

(૫૯) ગાણ ત્યાજ્ય વસ્તુઓ

પયગમબરે ઈસ્લામ(૩) ફરમાવે છે કે “સમગ્ર માનવની ગાણ વસ્તુઓ બધા માટે મનાઈ કરેલી છે. તેનું ખુન, તેની મિલકત અને તેનું સન્માન.” આ સિદ્ધાંત માનવ-માનવ

વયેની હદ્દો ની સ્વતંત્રતા બતાવે છે. સમગ્ર માનવ સ્વતંત્ર છે. પરંતુ તેની આ સ્વતંત્રતાની હદ્દો પૂરી થઈ જાય છે જ્યારે તે અન્ય માનવીની જુંદ્ગી, મિલકત અને સંમાન માટે ધમકી બની જાય છે.

આ દુનિયામાં માનવને સ્વતંત્રતા આપવામાં આવી છે, કારણકે સ્વતંત્રતા વિના પ્રગતિ શક્ય જ નથી. પરંતુ આ સ્વતંત્રતા અસીમિત નથી. એક માણસ ત્યાં સુધી જ સ્વતંત્ર છે જ્યાં સુધી તે બીજાની જુંદ્ગી-મિલકત અને સંમાનને નુકશાન ન પહોંચાડે. આ ગ્રાશ વસ્તુમાં જો તે ધમકીરૂપ થાય તો તેની સ્વતંત્રતા પૂરી થઈ જાય છે. તો તેને ઈશ્વરદ્વાત સ્વતંત્રતાનો હક્ક છીનવી લેવામાં આવશે.

(૬૧) દરેક જવાબદાર છે

પયગમ્બરે ઈરલામ(૧૩)એ ફરમાવ્યું “સાંભળો, તમારામાંથી દરેક ભરવાડ છે. (પોતાના કુટુંબનું રક્ષણ કરનાર). તમને દરેકને તમારા કુટુંબ વિશે પુછવામાં આવશે.” (સંદર્ભ ગ્રંથ સહિત બુખારી હદ્દીસ નં.૮૮૩). આ પયગમ્બર સાહેબના કથનમાં આપણાને જુંદ્ગીનું સહય ઉદાહરણ આપીને સમજાવવામાં આવેલ છે. દાખલા તરીકે ભરવાડ જેવી રીતે તેની બકરીઓની સાચવણી કરે છે તે જ રીતે દરેક માણસે પોતાના કુટુંબની દેખરેખ રાખવી જોઈએ.

ઉદાહરણ તથા જેવી રીતે ભરવાડ તેના બકરીઓના ટોળાની દેખરેખ કરનાર હોય છે તેવીજ રીતે માણસ પોતાના નીચે આવતા લોકોનું ધ્યાન રાખનાર હોય છે. તેણે તેના કુટુંબની દરેક જતાની સંભાળ રાખવી જોઈએ. તેવીજ રીતે દરેક સ્કુલ-કોલેજના લણાવવા વાળા ટીચરની જવાબદારી તેમના વિધ્યાર્થીઓ માટે હોય છે. તેણે પ્રશિક્ષણની જવાબદારી સંપૂર્ણ તથા દિલથી અદા કરવી જોઈએ. તેવીજ રીતે સમાજના લીડર-નેતાએ પણ તેની ફરજ યોગ્યરીતે નિભાવવી જોઈએ. તે તેમના અનુયાયીઓનો ઉત્કૃષ્ટ શુભેચ્છુક હોવો જોઈએ. તેવીજ રીતે પ્રેસીડન્ટ અથવા પ્રમુખ જે કોઈ સંસ્થાના હોય, તેમણે પણ સુંદર રીતે પોતાની જવાબદારી નિભાવવી જોઈએ, અને સંસ્થાને વધુ ને વધુ આગળ વધારવા કોશિસ કરવી જોઈએ.

(૬૨) દ્રેકને મદ્દરૂપ થાઓ

પયગમભરે સાહેબ(૩૫)એ એક વખત ફરમાવ્યું “પોતાના ભાઈની મદ્દ કરો, લલેને તે જુલ્બી કેમ ન હોય? લોકોએ પુછ્યું “અમે જાણીએ છીએ કે પિડીતની મદ્દ કરવી જોઈએ પરંતુ જે પોતે જુલ્બ કરતો હોય તેની મદ્દ કેવી રીતે થઈ શકે?” આપે સ્પષ્ટતા કરતાં કહ્યું “જુલ્બ કરનારને જુલ્બ કરતાં રોકવો એ પણ એક જાતની તેની મદ્દ જ છે ને! (સંદર્ભ ગ્રંથ સહિત બુખારી હદીસ નં. ૨૪૪૪). ઈસ્લામ દ્રેક માનવના મનમાં એ વાત હસાવવા માંગે છે કે દ્રેકના શુલ્ષેષ્યુક બનો, અને તેને સારા બનવા માટે દ્રેક રીતે મદ્દ કરો. જુલ્બ કરનારને જુલ્બ કરવાથી રોકવો એ જ એને મદ્દ કરવી છે કારણકે તે જુલ્બ નહિં કરે તો તે એક મોટા ગુના થી બચી જશે. જુલ્બ કરનારને રોકવો એનો અર્થ એવો થતો જ નથી કે તેની સાથે લડવું. ખરેખર તેની સાચી મદ્દ એ છે કે તેને તે શું ખોટું કરે છે તે સમજાવવું. તેને આવું ન કરવા માટે વિનંતી કરવી જોઈએ. તેને એવી રીતે સમજાવવું જોઈએ કે તે ખરાબ કામ કરવાનું છોડી હે, અને તેને તેની ભૂલ દેખાય. જુલ્બીને મદ્દ કરવાનો અર્થ એવો નથી કે તેનાથી નફરત કરવામાં આવે. આનાથી ઊંઠાં તેની સાથે નરમીથી વર્તવામાં આવે અને તેનું ભલું જ કરવામાં આવે. નફરતથી જુલ્બમાં વૃદ્ધ થાય છે, તેથી તેની સાથે સારી રીતે વર્તન કરવાથી જુલ્બનો અંત આવી જશે.

(૬૩) સૌમ્ય આચરણ

પયગમભરે ઈસ્લામ(૩૫)એ એક મુસાફીરીમાં આપના સાથીઓને કહ્યું-સલાહ આપી કે “સૌમ્ય આચરણ કરતા રહેજો. તમને સરળતા પયદા કરવા માટે મોકલવામાં આવ્યા છે, મુશ્કેલી પયદા કરવા માટે નથી મોકલવામાં આવ્યા.” (સંદર્ભ ગ્રંથ સહિત બુખારી હદીસ નં. ૩૦૩૮). આ પયગમભર સાહેબનું કથન એ લોકો માટે જ છે જેઓ વિવિધ ક્ષેત્રોમાં કામ કરતા લોકોને લાગુ પડે છે. એક અધિકારીએ હમેશાં તેમના કર્મચારીઓ સાથે આ જ સિધ્ધાંત થી કામ કરતા રહેવું જોઈએ. એક શિક્ષકે પણ તેના વિધ્યાર્થીઓ સાથે નમ્રતાથી જ કામ કરવું જોઈએ. એક મેનેજરે પણ તેની કંપનીના માણસો સાથે સૌમ્યતાથી કામ કઢાવવું જોઈએ, અને તેવીજ રીતે દ્રેક ક્ષેત્રના લોકોએ સૌમ્યતા પોત પોતાના ક્ષેત્રમાં અપનાવવી જોઈએ.

દેક માણસે આ સલાહ સતત ધ્યાનમાં રાખવી જોઈએ. માણસને ઈશ્વરે જ મોકલ્યો છે તેથી તમે ઈશ્વરને તેમાં જ શોધો. તેણે માણસોને મુસીબતમાં ન મુકવા જોઈએ. મનુષ્યે દેક વાતમાં સરળતા પયદા કરવી જોઈએ.

(૬૪) દ્યા માટેના સૂત્રો

પયગમભરે ઈલ્લામ(૩)એ ફરમાવ્યું કે “જમીન વાળાઓ ઉપર દ્યા કરો તો આસમાન વાળો તમારા પર દ્યા કરશો.” (સંદર્ભ ગ્રંથ સુનન અબુ દાઉદ, હદીસનં. ૪૮૪૧). કુદરતી રીતે જ દેક મનુષ્યમાં સારા કામો કરવાની વૃત્તિ આપવામાં આવી છે જે કયારેય પુરી થતી જ નથી. દેક માનવને જીવનના વિવિધ તબક્કામાં ઈશ્વરીય મદદની જરૂર તો પડે જ છે. ઈશ્વરીય મદદ વિના આ દુનિયામાં સફળ થવું અશક્ય જ છે. સૌથી સાદ્યામાં સાદો રસ્તો જે પોતાને જોઈતું હોય તે બીજાને આપવું છે. એવું કરવાથી તમને પણ મદદ મળશે જ. જો તમે ઈશ્ચતા હો કે ઈશ્વરીય મદદ તમને મળે તો તમારે બીજાને મદદ કરવી જોઈએ. જો તમે ઈશ્ચતા હો કે ઈશ્વર તમારા પર કૃપા કરે તો તમારે લોકો ઉપર કૃપા કરવી જોઈએ. જો તમે ઈશ્ચતા હો કે ઈશ્વર તમને માદ્દી આપે તો તમારે લોકોને માફી આપવી જોઈએ.

કોઈ મનુષ્ય સાથે દ્યાભાવ અને લાગણીથી કોઈ કાર્ય કરવું એવું છે જાણે કે તમે ઈશ્વરને કહી રહ્યો હો કે “અય ઈશ્વર, હું તારા દાસ સાથે દ્યાળુતા અને લાગણીથી વર્તુ હું તો તું મારી સાથે પણ આવીજ લાગણી અને દ્યાળુતા થી વર્તન કર.”

(૬૫) પરસ્પર આદરભાવ

ખુદા તથાલા હુલ્લુર(૩)ને ઈર્શાદ કરે છે ઈન્કારીઓને કહો કે-- “અય લોકો તમારો ધર્મ તમારા માટે અને મારો ધર્મ મારા માટે.” (કુરાઅન ૧૦૮/૬). કુરાઅની આ આયત બતાવે છે કે જ્યારે તમે વિવિધ ધર્મની સોસાયટીમાં રહેતા હો, જ્યાં વિવિધ પ્રથાઓ હોય ત્યાં કઈ રીતે રહેવું. આનો સુંદર અને સાદો ઉપાય એ છે કે એક ને જ અનુસરવું અને આદર બધાનો કરવો.

બહુધર્મિય સોસાયટીમાં અપનાવવા જેવો આ જ સુંદર ઉપાય છે. આ વિવિધતાવળી દુનિયામાં એ શક્ય જ નથી કે બધા જ તફાવતો દુર થઈ જાય. આવી સિથીમાં એકજ વ્યહવારુ

સૂચન છે કે દેરેકે સહનશીલતા કેળવવી જોઈએ. બીજા શબ્દોમાં કહીએ તો દરેકને હક્ક આપવો જોઈએકે પોતાનો ધર્મ, પોતાનું કલ્યાર (સંસ્કાર-સંસ્કૃતિ) કે પોતાની પરંદને અનુસરી શકે. આપણે શાંતિમય ચર્ચા, દેરેક તફાવતો માટે કરી શકીએ, પરંતુ જો આપણે ભતસેદો-તફાવતો દુર કરવા જઈશું તો તેનાથી તો વધુ પ્રમાણમાં તફાવતો (ભતસેદો) પેદા થશે.

(૬૬) દરેક ધર્મને માન આપવું

થોડાક યહુદી ધર્મના અનુયાયીઓ પયગમ્બર સાહેબ (ﷺ)ના સમયમાં મદ્દીનામાં રહેતા હતા. એક વખત પયગમ્બર સાહેબ એક જગ્યાએ બેઠા હતા અને એક યહુદીની અંતિમયાત્રા નીકળી તો પયગમ્બર સાહેબ તેને જોઈને ઉભા થઈ ગયા (અને તેને માન આપ્યું). આપના એક સાથીએ કહ્યું કે આ અંતિમયાત્રા તો યહુદીની છે. પયગમ્બર સાહેબએ તુરતજ જવાબ આપ્યો “શું તે માણસ ન હતો?” (સંદર્ભ ગ્રંથ સહિહ બુખારી હદીસ નં. ૧૩૧૨).

આ પ્રથા બતાવે છે કે માણસે દરેકને દરેક સંજોગોમાં માન આપવું જોઈએ, પણ લલે ને તે યહુદી હોય કે અન્ય ધર્મનો કે અન્ય સંસ્કૃતિ (culture) નો કેમ ન હોય? આપણે કોઈનાય પ્રત્યે તુચ્છકારવૃત્તિ રાખવી જ ન જોઈએ. હકીકત એ છે દરેકને ઈશ્વરે જ બનાવેલ છે, તેથી દરેક માનવ એટલો જ માન આપવાને લાયક છે જેટલો પોતાના ધર્મનો માનવી.

(૬૭) દુશ્મનમાં ભિત્ર

ખુદા તથાલા કુરાન શરીફમાં ફરમાવે છે કે “જો કોઈ તમને દુશ્મન માને છે તો પણ તમે તેની સાથે દુશ્મની ન કરો. તેનાથી સુંદર રીતે વર્તન કરો.” (કુરાન ૪૧/૩૪). આ એક પક્ષીય વર્તન તમને દુશ્મન માંથી દોસ્ત બનાવી દેશે. ઈસ્લામનો આ ઉપદેશ વર્ણવે છે કે દુશ્મની કાયમી હોતી નથી. હકીકત એ છે કે દુશ્મનમાં પણ દોસ્ત છુપાયેલો હોય છે. તમે આ શક્યતાને હકીકત બતાવવા માટે દુશ્મન ને એકપક્ષીય રીતે સારું વર્તન કરીને જોશો કે તે તમારો દુશ્મન તમારો ભિત્ર બની જશે.

કોઈનાય એકપક્ષીય પ્રેમભાવથી સામેના વ્યક્તિનો અંતરાત્મા જાગૃત થાય છે તો તે તમારો ભિત્ર બની જાય છે.

(૬૮) મૂઢુતાનો અભાવ

પયગમબરે ઈસ્લામ(૩૩)એ ફરમાવ્યું “જે કામમાં નમતા નહિં હોય તે કામ દરેક ભલાઈથી વંચિત રહેશે.” (સંદર્ભ ગ્રંથ સુનન અબુ દાઉદ હદ્દીસ નં. ૪૮૦૮). આ પયગમબર સાહેબનું કથન (હદ્દીસ) એક બહુન્યાયી નૈતિક સિધ્યાંત બતાવે છે અને બતાવે છે કે દરેક કાર્યમાં દ્યા ટપકવી જોઈએ (બીજા સાથેના કામોમાં).

જે માણસે દરેક કામમાં નમતા અપનાવી સમજો કે તે દરેક ચીજમાં સફળ થઈ ગયો. આવા માણસનો કોઈ દુશ્મન નથી હોતો. આવો માણસ અજાતશરૂ હોય છે. આનાથી વિપરીત કોઈ માણસ દરેક કામમાં કઠોરતા અપનાવે તો દરેક કામ ઉલટું થશે અને દરેક તેની ફરીયાદ કરશે. તેને દુશ્મની અને વિપરીત પરિસ્થિતીમાં જ રહેવાનું આવશે. તેને કારણ વિનાના પ્રશ્નનો નો અંદર અને બહારથી સામનો કરવાનો આવશે (ઘરની અંદર અને ઘરની બહાર).

(૬૯) સાદાઈનું મહત્વ

પયગમબરે ઈસ્લામ(૩૩)એ ફરમાવ્યું છે કે “સાદાઈ એ ઈમાનની નિશાની છે. સાદાઈ એ હેતુમય માણસનો રસ્તો છે” (સંદર્ભ ગ્રંથ સુનન અબુ દાઉદ હદ્દીસ નં. ૪૦૬૧). એક હેતુમય માણસ તેનો સમય અને તેની શક્તિ-લક્ષ્યિયસ જુંદ્ગી જીવવા માટે વાપરી શકે જ નહિં. સાદાઈ એટલે પોતાની જરૂરીયાતને ઓછામાં ઓછી રાખી કારણ વિનાના નકામા રોકાણોમાં ન ફસાવું. સાદાઈ એ સુંદરતમ્ ઉપાય છે! સાદાઈથી માણસને હેતુમય જુંદ્ગી જીવવા મળે છે. તેના જીવનનો કોઈપણ ભાગ નકામો વેડફસ્ટો નથી; સિવાય કે તેના જીવનનો ધ્યેય પ્રાપ્ત કરવાના માર્ગ જ વપરાય છે.

બૌદ્ધિક વિકાસ માટે આસાન બાબત એ છે કે તેની અંદર વિચારવાની પ્રક્રિયા સતત ચાલુ જ રહેવી જોઈએ. સાદાઈ એ આ ક્રિયામાં બહુજ મદ્દરૂપ થાય છે. સાદાઈથી માનવ મનમાં સ્પષ્ટતા વધે છે, નકામા કાર્યોમાં જુંદ્ગી વેડફસ્ટી નથી.

(૭૦) સ્વર્ણતાની અગત્યતા

પયગમબરે ઈસ્લામ(૩૩)એ ફરમાવ્યું કે “સ્વર્ણતા એ ઈમાનની એક શાખા છે.” (સંદર્ભ ગ્રંથ સહિહ મુરિલમ હદ્દીસ નં. ૩૨૮). આ હદ્દીસ બતાવે છે કે સ્વર્ણતાની અગત્યતા અને ઈસ્લામમાં વાતાવરણની સ્વર્ણતાની અગત્યતા! ઈસ્લામ તેની પ્રકૃતિમાં જ દિલની સ્વર્ણતા (પાકીજારી) અને આત્માની પવિત્રતામાં માને છે.

ઈસ્લામ તેના સ્વભાવમાં જ દિલની પવિત્રતા અને મનની પવિત્રતામાં માને છે. મનના ખરાબ વિચારો દૂર કરો અને પવિત્ર હકારાત્મક જીંદગી જીવતા રહો. ઈસ્લામ અંતરાત્માની સફાઈ અને સુંદર વિચારો માંગો છે. જેવી રીતે માનવી પોતાનું શરીર ધોઈને પવિત્ર કરે છે તેવીજ રીતે મન પણ પવિત્ર કરવું જોઈએ. માનવી એ પોતાના શરીર અને મનને પણ પવિત્ર કરવું જોઈએ.

જ્યારે માણસ પોતાનું અંતરાત્મા સ્વર્ણ કરે છે ત્યારે સ્વભાવિક રીતે તેને ઈચ્છા થાય કે તે તેનું બાબુ પણ સ્વર્ણ કરે. તેણે પોતાના શરીર અને વસ્ત્રોનું પણ ધ્યાન રાખવું જોઈએ. તેણે પોતાનું ઘર અને આજુબાજુ નું વાતાવરણ પણ સ્વર્ણ રાખવું જોઈએ. આવું કરવાથી જ સ્વર્ણતા તેના જીવનનો અભિના હિસ્સો બની જશે.

(૭૧) મધ્યમાર્ગીપણું

પયગમબરે ઈસ્લામ(૩૩)એ ફરમાવ્યું છે કે “(દ્વેક રીતે) મધ્યમ માર્ગ ઉત્તમ છે.” (સંદર્ભ ગ્રંથ સહિહ બુખારી હદ્દીસ નં. ૩૫૬૦). સાંપ્રત સમયમાં માણસે અનેક જાતના માણસો સાથે જ રહેવાનું હોય છે. આવી સ્થિતી માં કોઈનો ય રસ્તો રોક્યા વિના કોઈને ય નર્યા વિના જીવવું એ જ અગત્યનું છે. આને જ મધ્યમ માર્ગ કહેવામાં આવે છે. આ મધ્યમ માર્ગ જ હમેશાં ઈચ્છનીય છે. આ એકજ રસ્તો છે જેમાં માણસ પોતાને ભયમાં મુક્યા વિના આગળ વધી શકે છે. આ રસ્તે જ માણસ પોતાના પ્લાન પ્રમાણે આગળ વધી શકે છે અને પોતાની મુસાફરી પુરી કરી શકે છે.

(૭૨) નમ્રતા દ્વારા ઉન્તાતિ

પયગમબરે ઈસ્લામ(૩૩)એ કહ્યું કે “જેઓ નમ્રતાનો માર્ગ અપનાવે છે તેમને ઈશ્વર આગળ ધપાવશે.” (સંદર્ભ ગ્રંથ સુનન ઈબ્ને માજાહ હદીસ નં. ૪૧૭૬). આ નિયમ ઈશ્વર દ્વારા બનાવવામાં આવ્યો છે. નમ્રતાથી પ્રગતિના દરવાજા ખુલ્લી જાય છે. જ્યારે ઘમંડનો માર્ગ માણસને નીચતા તરફ લઈ જાય છે. આધ્યાત્મિક જાગૃતિ ઉમદા ગુણો છે. તે જે લાકો નમ્ર હોય છે તેમાંજ જોવા મળે છે. તેઓને દૈવિ પ્રેરણા મળે છે. તેનાથી તેઓ પ્રકૃતિની વધુ સુંદર પ્રશંસા કરતા થાય છે. તેઓને જે ચીજો જેવી હોય છે તેવી દેખાય છે.

નમ્ર વલશ વિરોધીનો અંતરાત્મા ને જાગૃત કરે છે. પરિણામ તથા તેને ફરજ પડે છે કે તે તેની નૈતિક મહાનતાનો સ્વિકાર કરે. નમ્રતા એ એક જાતની વર્તણુંક છે તેના માટે માણસે કાંઈ ખર્ચ કરવો પડતો નથી. તેણે કાંઈ ગુમાવ્યા વિના ધણું બધું મેળવે છે. ઘમંડનું વલશ ખોટું હોય છે અને નમ્રતાનું વલશ સાચ્યું જ હોય છે.

(૭૩) નકામો ખર્ચ

કુરાન શરીફમાં ખુદા તમાલા એ જે સાચી જરૂરીયાત વિના ખર્ચો કરે છે તેને નકામા ખર્ચો કહ્યા છે (કુરાન ૭/૩૧). પયગમબર સાહેબ(૩૩) કહે છે કે આ પણ નકામો ખર્ચો છે કે જ્યારે પણ તમારે ખાંચું હોય ત્યારે ખાઈ લો એ પણ નકામો ખર્ચ જ છે. (સંદર્ભ ગ્રંથ સુનન ઈબ્ને માજા હદીસ નં. ૩૩૫૨). આ માણસનો અધિકાર છે કે ખરેખરી જરૂરીયાત ઉપર ખર્ચ કરે. પરંતુ કોઈને ય એ અધિકાર નથી કે મન ફાવે ત્યાં ખર્ચ કરે! ઈશ્વરે જો તમને વધારાની દોષત આપી હોય તો તે ફક્ત પોતાના ઉપર જ ખર્ચ કરવા નથી આપી. ઈશ્વરે તેને જ્યાં ખર્ચ કરવાનું કહ્યું છે તે જગ્યાએ જ ખર્ચ કરવો જોઈએ. જે માણસ આ જાતની જુંદળી જીવતો નથી તો જાણો કે તે ઈશ્વરીય અનામતને વેડફે છે.

(૭૪) સામુહિક આશિર્વાદ

પયગમબરે ઈસ્લામ(૩૩)એ કહ્યું છે કે “એક માણસનું જમવાનું બે માણસ માટે પૂરતું છે. બે નું જમવાનું ગણ માણસ માટે પૂરતું છે.” (સંદર્ભ ગ્રંથ સુનન ઈબ્ને માજાહ હદીસ નં.

તરપણ). આ પયગમ્બર સાહેબનું કથન આપણને સાથે સાથે રહેવાનું અને સાથે સાથે જવવાનું શીખવાડે છે.

આમાં ખોરાકનું ઉદાહરણ છે તે તો એક માત્ર પ્રતિકાત્મક જ ઉદાહરણ છે. આ પયગમ્બર સાહેબનું કથન છે તે જવનની દરેક વાતો સાથે સંલગ્ન થાય છે. જો માણસો સાથે જ કામ કરે અને સાથે જ રહે, તો થોડાક જ માણસો મોટો ધ્યેય મેળવી શકે. ઘણા માણસો નાનકડા ઈનવેસ્ટમેન્ટ-રોકાજા ઉપર પણ લાભ મેળવી શકે છે. જો દરેક માણસ તેનું કામ અલગ અલગ કરે તો, તો તેમને આનો થોડો જ લાભ મળશે. પરંતુ જો આ લોકો સાથે સાથે કામ કરે તો દરેકને તેનો લાભ મળશે જ.

(૭૫) ન્યાય માટે ની માંગણી

પયગમ્બરે ઈસ્લામ(ﷺ)એ એક વખત મદીનામાં લોન એક માણસ પાસેથી લીધી હતી. એક દિવસ તે માણસ આવી ને ઉધૃત શર્ષ્ટોમાં તેમના પૈસા પાછા લેવા ઉધરાણી કરવા લાગ્યો. પયગમ્બર સાહેબના સાથીઓ તેની ઉધૃતાઈ બદલ તેને સજા આપવા માંગતા હતા. પરંતુ પયગમ્બર સાહેબે તેમને અટકાવ્યા અને કર્વું કે સાચા માલિકને કહેવાનો અધિકાર છે. (સંદર્ભ ગ્રંથ સહિત બુખારી હદ્દીસ નં. ૨૩૦૬). આ લોકો સાથે કેવી રીતે વર્તન કર્વું તેનું ઉત્તમ ઉદાહરણ છે. જો કોઈ કારણ હોય તો લોકો તુરતજ ગુસ્સે થઈ જાય છે અને બહુજ અસર્યતાથી વાત કરે છે. સાંભળનારે બહુજ ધીરજથી કામ લેવું જોઈએ. જો માણસમાં આવા શર્ષ્ટો સાંભળવાની શક્તિ ન હોય તો ઉછીની કોઈ ચીજ ન લેવી જોઈએ. પૈસા કોઈ પાસેથી લીધા હોય તો આપનારનો હક્ક છે કે તે તેની લાગણી વ્યક્ત કરે. આવા કિસ્સામાં લેનારાએ સંયમ રાખવો જોઈએ. તે ઉલદું આપનારને ધીરજ રાખવાની સલાહ આપી શકે નહીં:

(૭૬) પોતાના અધિકાર કરતાં વધુ લેવું

પયગમ્બરે ઈસ્લામ(ﷺ)એ એક વખત ફરમાવ્યું “જમીનના ઝગડામાં, જો લૂલથી કોઈ ખોટા વાચાળને જમીન અપાઈ જાય તો તેણે તે જમીન ન લેવી જોઈએ. સમજુ લો કે આ જમીન એક આગનો ટુકડો (જ) છે.” (સંદર્ભ ગ્રંથ મુસનદે એહમદ હદ્દીસ નં. ૨૬૭૧૭).

આ હદ્દીસ બતાવે છે કે કોઈ વસ્તુ કોઈની નથી જો ન્યાયાલય પણ તેના પક્ષમાં હુકમ આપે તો પણ તે જો તેની નહિં હોય તો તેની નહિં જ થાય. સત્યને કોર્ટનો નિર્જય પણ બદલી ન શકે.

સાચી વાત એ છે કે ગેરકાયદે કબજો કરવાથી, ન્યાયાલયનો ફેસલો પણ ખોટી વાતને સાચી ઠેરવી શકતો જ નથી. જો માણસનો અંતરાત્મા કહે છે કે તેણે જે કબજો કરેલ છે તે તેનું નથી તો તેણે તેનો જે માલિક છે તેને પાછું આપી દેવું જોઈએ, અને બીજાનો હક્ક ન મારવો જોઈએ. માણસનો અંતરાત્મા એ જ સાચું ન્યાયાલય છે. મોટામાં મોટો નિર્જય આત્માની કોઈ જ લે છે.

(૭૭) જેવું કરશો તેવું જ પામશો

પયગમ્બરે ઈસ્લામ(ﷺ)ની હદ્દીસમાંથી એક હદ્દીસ છે કે “એક મોમિન બીજા માટે પણ એ જ પસંદ કરે છે જે પોતાના માટે પસંદ કરે છે.” (સંદર્ભ ગ્રંથ સહિહ બુખારી હદ્દીસ નં. ૧૩). આ એક બહુવ્યાપી સિધ્યાંત, સામાજિક નીતિશાસ્ત્ર નો છે. દરેક માનવને ખબર છે કે કઈ વર્તણુંક તેને ગમે છે અને કઈ વર્તણુંક તેને ગમતી નથી. આ વસ્તુ જ બીજા માટે કરવી જોઈએ. માણસે બીજા માટે પણ એ જ રીતે પસંદ કરવી જોઈએ જે પોતાના માટે પસંદ કરે છે. આ નૈતિકતા નો સિધ્યાંત એટલો બધો સાદો છે કે દરેકને તેની જાણ છે જ! દરેકે આ બાબતે એકદમ સહદ્યી હોવું જરૂરી છે. જે લાગણી પોતાની જાત માટે અપનાવીએ છીએ તે જ લાગણી અન્યો માટે પણ અપનાવવી જોઈએ. જો બધા જ લોકો આ સાદો નૈતિક સિધ્યાંત અપનાવી લે તો સમાજમાં સારા પણ અને શાંતિનું સામાજય સ્થપાઈ જાય !!

(૭૮) આર્થિક સ્થિરતા

પયગમ્બરે ઈસ્લામે ફરમાવ્યું કે “જ્યારે ઈશ્વરે કોઈના ભરણપોષણ માટે કોઈ સ્ત્રોત બનાવ્યો છે તો તેણે પોતાના મેળે આ સ્ત્રોત છોડવો ન જોઈએ; સિવાય કે કોઈ સંજોગોની મજબુરીને કારણે તેણે તે છોડવું પડે.” (સંદર્ભ ગ્રંથ મુસ્નાદ એહમદ હદ્દીસ નં. ૨૦૬૪૮). ઈસ્લામના શિક્ષણ પ્રમાણે ભરણપોષણ (રોજ) ઈશ્વર તરફથી જ હોય છે. તેથી જો માણસને ભરણપોષણ નો સ્ત્રોત મળે તો તેણે ઈશ્વરનો આભાર માનવો જોઈએ, અને તેને છોડવો ન

જોઈએ. જો તે કોઈ યોગ્ય કારણ વિના છોડી છે તો ઈશ્વરની તરફેણ ગુમાવશે. ખંત જીવનની સફળતાનું રહસ્ય છે. આર્થિક જીવનમાં સફળતા હમેશાં સાખત મહેનતથી પ્રાપ્ત યાય છે. આ આપણને ખંત અને સ્થિરતા શીખવે છે. માણસે હમેશાં પોતાના લાવિ તરફ ધ્યાન રાખવું જોઈએ. નહિ કે પોતાના વર્તમાન તરફ !! આ હદ્દીસ આપણને શીખવાડે છે કે આપણે વર્તમાન સ્થિતી જોઈને નાહિંમત ન થવું જોઈએ; પરંતુ આપણે ભવિષ્ય નજરમાં રાખીને આર્થિક વિકાસ માટે સતત કાર્યશીલ રહેવું જોઈએ.

(૭૮) ઈશ્વરીય જોગાવાઈ

ખુદા તથાલા ફરમાવે છે કે “બધા જ જીવનની, જેઓ ધરતી ઉપર છે તેની આજીવિકાની જવાબદારી ઈશ્વરની (પોતાની) છે.” (કુરાન ૧૧/૬). પયગમ્બર સાહેબ પણ કહે છે કે ઈશ્વરે જ્યારે નસીબ કરેલ હોય ત્યારે કોઈ તેને રોકી શકતું જ નથી. પછી તે સ્ત્રી હોય કે પુરુષ! કોઈ માણસ તેમાં વધારો કે ઘટાડો નથી કરી શકતો. (સંદર્ભ ગ્રંથ મુજમ-અલ કબીર હદ્દીસ નં. ૭૬૮૪). આ હદ્દીસથી જાણવા મળે છે કે કોઈ સ્ત્રી કે પુરુષ ઈશ્વરીય કૃપાને રોકી શકતું જ નથી. આ રીતે વિશ્વાસ રાખનારને બે લાસો મળશે. પહેલું એ કે તેને વિશ્વાસ રહેશે કે જે નસીબમાં હશે તે ક્યાંય જતું રહેવાનું નથી. અને બીજું તે આ રાહત સાથે કામ કરશે તેને તેના પ્રયત્નોનું ફળ મળશે જ. અને તેની જોગાવાઈ વચ્ચે કોઈ જ અડચણ આવી શકે તેમ જ નથી. આ નિર્વાહ એ ઈશ્વર તરફથી અપાયેલ અધિકાર છે તેને કોઈજ રદ કરી શકે તેમ નથી. આ માન્યતાથી માણસના આંતરમન માંથી નિરાશા દૂર થાય છે. તે તકલીફો વચ્ચે ઉસા રહીને પણ કહી શકે છે કે કોઈ મારી નોકરી લઈ શકે તેમ નથી. કોઈપણ મારા ભાગ્યથી વધી ને નથી.

(૮૦) સંતોષ

પયગમ્બરે ઈસ્લામ (ﷺ)એ ફરમાવ્યું કે “સફળ માણસ તે છે જેને ઈશ્વરે જરૂર પુરતી રોજ આપી છે અને તે તેનાથી સંતોષિત છે.” (સંદર્ભ ગ્રંથ સુનન ઈબ્ને માજા- હદ્દીસ નં. ૪૧૩૮). નિરોક્ષણોથી સ્પષ્ટ જાણવા મળે છે કે, સફળતાનું રહસ્ય એ છે કે માણસ સંતોષિત હોય. જે તેને મળેલ હોય તેનાથી ! અને જે તેને મળ્યું નથી તેનાથી દુઃખ ન અનુભવે! જ્યારે પણ માણસ પોતે સાચા સિધ્ધાંતો થી જીવન સ્થાપન કરવાની કોશિશ કરશે તો તેને જરૂર પુરતું

તો મળી જ રહેશે. અને જો તેને જે મળ્યું હોય તેના સાથે સંમત થશે તો તેને માનસિક શાંતિથી અપૂર્વ આનંદ મળતો રહેશે. શાંતિ હમેશાં સંતોષથી જ પ્રાપ્ત થાય છે. એનો બીજો અર્થ એ થાય છે કે તેને જે મળ્યું છે તેનાથી તે ખુશ છે. અન્ય રીતે કદીએં તો, જે કોઈ માણસ પોતાની પાસે જે કંઈ છે તે ભૂલીને, જે તેની પાસે નથી તેની પાછળ પડે છે તો તે કદીય સંતોષ નહીં પામે. કારણ કે આ દુનિયામાં અપાર વસ્તુઓ છે. ભલેને તમારી પાસે કેટલીય વસ્તુઓ કેમ ન હોય! છતાંય ઘણી વસ્તુઓ એવી હશે જેને લેવાની તમને ઈચ્છા હશે જ. આ રસ્તે જો જશો તો તમે વધુ ને વધુ લાલય કરતા જશો. પરિણામે માણસને મૃત્યુ સુધી બેચેની રહેશે.

(૮૧) બીજા પાસે કશુંય ન માંગો

પયગમબરે ઈસ્લામ(૩૩)એ કહ્યું છે કે “કોઈની ય પાસે કાંઈ પણ ન માંગો, કારણકે આપનાર હાથ લેનાર હાથ કરતાં ઉત્તમ હોય છે.” (સંદર્ભ ગ્રંથ સહિત બુખારી હદીસ નં. ૧૪૨૮). આ શિક્ષણ ઉચ્ચ માનવતા સાથે સંબંધિત છે. એ બહુજ અગત્યનું છે કે માણસ સ્વનિર્ભર હોવો જોઈએ, અને બીજાથી (વારંવાર) માંગતો ન ફરે. (વારંવાર) માંગવું એ સામાન્ય વસ્તુ નથી, તે માનસિક છાસની નિશાની છે. જે માણસ બીજાઓ પાસે માણ્યા કરે છે એ એવું છે જાણો કે જે સહેલું નિર્વાહ ઈચ્છે છે. આવા માણસે પોતાની જરૂરીયાત બીજાઓ પાસે માંગવા માટે ની કિમત ચુકવવી પડતી હોય જ છે. તેથી જ તે આના કારણે તે પોતાની ક્ષમતા વિકસાવી જ શકતો નથી. તેની આંતરિક ક્ષમતા-શક્તિ સુખુપ્ત અવસ્થામાં રહી જાય છે. તેની સખત મહેનત કરવાની તાકાત મંદ પડી જાય છે. તેને આરામ નામની બિમારી લાગુ પડી જાય છે. સાચો રસ્તો એ છે કે પોતાની જાત ઉપર વિશ્વાસ કરો અને સખત મહેનત કરવા તૈયાર રહો. પોતાના જ પગ ઉપર ઊભા રહેતાં શીખો. દ્રેક માણસે આપનાર બનવું જોઈએ, લેનાર ન બનવું જોઈએ.

(૮૨) વેપાર એ આજીવિકાનો મુખ્ય સ્ત્રોત છે

પયગમબરે ઈસ્લામ(૩૩)એ કહ્યું છે કે “૮૦% જોગવાઈ વેપારમાં છે,” (કન્જુલ ઉમ્માલ હદીસ નં. ૮૮૪૨). કુદરતી નિયમ પ્રમાણે ઈશ્વરીય બનાવટ યોજના પ્રમાણે, મહત્તમ ભાગ નિર્વાહનો વેપારમાં રાખવામાં આવ્યો છે. આ હદીસ દ્રેક માણસ માટે આશાનો ખજાનો

છ. જો માણસને કોઈ ધંધો-નોકરી ન મળે, વારસાડીય હક્કો ન મળે, અથવા અન્ય જગતાએથે કાંઈ પણ પ્રાપ્ત ન થાય તો તેણે પોતાનો વેપાર કરવો જોઈએ. તેને વેપારથી વધુ પૈસા પ્રાપ્ત થશે જે અન્ય સ્ત્રોતથી નહીં મળે.

(૮૩) આજીવિકા

પયગમબરે ઈસ્લામ(૩) ફરમાવે છે કે “અલ્લાહ તેના તે બંદાને ચાહે છે જે પોતાની આજીવિકા મહેનતથી પયદા કરે છે.” (સંદર્ભ ગ્રંથ અલ મુકાસીકુલ હસનાલ્હ હદીસ નં. ૨૪૬). આ હદીસ બતાવે છે કે દરેક માનવે પોતાની આજીવિકા પોતેજ પયદા કરવી જોઈએ. આજીવિકા પયદા કરવી એ સહેલી વાત નથી તેના માટે સખત મહેનત કરવી જરૂરી છે. ખરેખર જોઈએ તો સખત મહેનત એ જ માનવ ગુણોનો લંડાર છે તેમ કહીએં તો ખોટું નથી. મજુરોની જોગવાઈ સૌથી કાયદેસર છે. મહેનતથી કમાવવું એ માણસને જમીન સાથે સંલગ્ન રાખે છે. સખત મહેનત ની જોગવાઈ આદમીનો સ્વત્તમાવ બતાવે છે. સખત મહેનતથી માણસ આણસુ થતો નથી. તેમાં સુસ્તી આવતી નથી. સખત મહેનતથી માણસમાં ઉમદા વ્યક્તિત્વ ઊલરે છે. જો બળજબરી ન હોય તો માણસે તેના આજીવન માટે મહેનત કરવી જ જોઈએ. ગમે તેવા સંજોગોમાં પણ તેણે એશ આરામી જુંઠાં જવવી જોઈએ નહિ.

(૮૪) જીબને વશમાં રાખવી

પયગમબરે ઈસ્લામ(૩)એ ફરમાવ્યું કે “જુડ્ગા હોવા માટે એ જ પૂરતું છે કે માનવ જે સાંસળે તે બધાને કહેતો ફરે.” (સંદર્ભ ગ્રંથ મુસનાદ બગુજાર હદીસ નં. ૮૨૦૧). આ હદીસથી એક સુંદર મજાનો સભ્યતાનો સિધ્યાંત જાણવા મળે છે કે માણસે બોલતા પહેલાં વિચારયું જોઈએ. સામાજિક જીવનમાં આપણે બીજાઓ પાસે ઘણી બધી નકારાત્મક વાતો સાંસળીએ છીએ. આપણે અનુભવથી જાણીએ છીએ કે જ્યારે જ્યારે સાંસળેલી વાતોનું પુનરાવર્તન થાય છે ત્યારે તે વાત એટલી બધી વિકૃત થઈ જાય છે કે ઘણી વખત મૂળ વાત કરતાં સંપૂર્ણપણે અલગ થઈ જાય છે. તેથી માણસે સાંસળીને વાતોનું પુનરાવર્તન ન કરવું જોઈએ. જો કે સારી વાતોનું પુનરાવર્તન કરવું કોઈ ખોટું કામ નથી. પરંતુ જો તે ખરાબ સમાચાર હોયતો, જો તે વાત સંપૂર્ણપણે જાણી ન લઈએ ત્યાં સુધી કોઈને કહેવી ન જોઈએ.

(૮૫) ગીબત-અપશંદો નું પ્રાયશ્ચિત

પયગમબરે ઈસ્લામ(૩)એ ફરમાયું કે “જો તમારાથી કોઈનીય ગીબત થઈ જાય તો તેનું પ્રાયશ્ચિત એ છે કે તેના માટે ઈશ્વરથી માફીની પ્રાર્થના-દુઆ કરવી જોઈએ.” (સંદર્ભ ગ્રંથ મહાસીકૃત હસનાલ હદીસ નં. ૮૦૪). ગીબત એટલે કોઈપણ માણસની ખરાબી તેની ગેરહાજરીમાં કહેવી, જે સાંભળવાથી તે માણસને ખરાબ લાગે! કોઈની ગેરહાજરીમાં તેને ન ગમે તેવી વાત કરવી એ દેખ વૃદ્ધ જ કહેવાય. જે માણસ વિશે તમે અપશંદો કચા હોય તેનું પ્રાયશ્ચિત એ છે કે તેના માટે ઈશ્વરથી પ્રાર્થના કરો કે તેના ગુનાઓ માફ કરે. (છે ને મોટી વાત?).

(૮૬) મહાન સલાહ

પયગમબરે ઈસ્લામ(૩)એક વાર તેમના સાથીઓ પાસે બેઠા હતા. તેમણે તેમના સાથીઓને કહ્યું “શું હું તમને સુંદર મજાની સલાહ ન બતાવું?” તેઓએ કહ્યું “જરૂર બતાવોજ.” આપે ફરમાયું “તમારી જીબની સંભાળ રાખો.” (સંદર્ભ ગ્રંથ અત્ય તિરમીજ હદીસ નં. ૨૬૧૬).

જીબની સંભાળ રાખવાનો અર્થ છે માણસે કોઈનું પણ કાંઈ પણ ખરાબ ન બોલવું જોઈએ. તેણે પોતાની જાતને સંભાળવી જોઈએ, દરેક હાલતમાં. જેથી બુરાઈનો ફેલાવો જ ન થાય. આ હડીકત છે કે જ્યારે માણસો જીબનો કંટ્રોલ કાબુ ગુમાવી દે છે ત્યારે જ સામાજિક બુરાઈઓ પયદા થાય છે. જીબ ઉપરનો કાબુ ઘડ્યો બધી સામાજિક બુરાઈઓ દુર કરે છે. એ ગંલીરતાની નિશાની છે કે માણસ બહુજ વિચારીને પોતાની જીબનો ઉપયોગ કરે. જીબનો દુર ઉપયોગ કરવાથી બીજાઓનું નુકશાન થાય છે. જ્યારે માણસ કઠોર કડવા શબ્દો-વેશ બોલે છે તો આ બધું થાય છે. તે અન્યોના દોષ દર્શન કરે છે, અફવાઓ ફેલાવે છે.

(૮૭) ધીરજ રાખવી અને ટાળવું

ધૈર્ય રાખવું એ ઈસ્લામનો એક ઉપદેશ છે. કુરાન શરીફમાં વાસ્તવાર ધીરજ ધરવાની તાકીદ કરવામાં આવી છે. તે વધુમાં કહે છે કે “ઈશ્વર ખાતર ધીરજ ધરો.” (કુરાન ૭૪/૭), “અને ધીરજ ધરો, તમારું ધૈર્ય ઈશ્વરીય પ્રેરણાથી જ છે.” (કુરાન ૧૬/૧૨૭). જ્યારે

માનવીની ધીરજ ઘટે છે ત્યારે તે ધીરજ અન્ય માનવીઓને પણ અસર કરતી હોય છે. પરંતુ વાસ્તવિક રીતે તે ઈશ્વરીય ર્યાનાની યોજના ની જ પુષ્ટિ કરવાનો સમાનાર્થી (જ) છે.

ઈશ્વરે આ સૂચિ જ એવી રીતે બનાવી છે કે દરેક માણસને સંપૂર્ણ સ્વતંત્રતા આપી રાખેલ છે. દરેક માણસને હરિફાઈની સંપૂર્ણ સ્વતંત્રતા છે. પરિણામે એક બીજાની સામે ફરીયાદ જોવા મળે છે. એક માણસને બીજા પાસેથી ગુમાવવાનું હોય છે. આવી અપ્રિય વાતોને સહન કરવા માટે ઈશ્વરથી સંતોષિત હોવું જરૂરી છે. તે માટે ઈશ્વરીય યોજના ધ્યાનમાં રાખવી જોઈએ. ઈશ્વરે ધીરજની અગત્યતા આ રીતે બતાવી છે. “ઈશ્વર ખાતર, ધીરજ ધરો.” (કુરાન ૭૪/૭). કુરાન શરીફમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ધીરજ ધરનારને બેહિસાબ બદલો આપવામાં આવશે.” (કુરાન ૩૮/૧૦).

(૮૮) એકપક્ષીય સહન કરવું

પથગમભરે ઈસ્લામ(ﷺ)એ ફરમાવ્યું કે “જ્યારે જેઓએ તમારાથી ખરાબ કર્યું હોય તેને માફી આપો.” (સંદર્ભ ગ્રંથ મુસ્લિમ એહમદ હદ્દીસ નં. ૧૭૪૫૨). આ શિક્ષણમાં મહાન ડાહાપણ છુપાયેલું છે. તે પરિણામદારી શિક્ષણ છે. જો કોઈ માણસ જુલ્દ કરે છે તો, જેના પર જુલ્દ કરવામાં આવે છે તેણે વિચારવું જોઈએ કે તેના જવાબથી પેલાના જુલ્દમાં વધારો તો નહિ થાય ને? આવું વિચારશે તો તેને ખ્યાલ આવશે કે જુલ્દીને માફ કરી દેવો એ જ મોટો બદલો લેવો છે. નિઃશંક જુલ્દીને માફી આપીને જુલ્દનો ખાતમો કરવો એ સહેલામાં સહેલો રસ્તો છે, જેનાથી જુલ્દ દૂર થાય છે. જુલ્દીને માફ કરી દેવો એ બાયલાપણાની નિશાની નથી. પરંતુ તે ઉચ્ચ કક્ષાની નૈતિકતાની નિશાની છે. સિધ્યાંતની વાત છે. અસહાયતાની વાત નથી જ નથી.

(૮૯) ટાળવાની રીત

કુરાન શરીફમાં ખુદા તઆલા હુકમ આપે છે કે “અજ્ઞાનીઓ અને મુરખાઓથી દૂર રહો.” (કુરાન ૭/૧૮૮). અત્યારની દુનિયામાં સફળ જીવન માટેની આ સુંદર ચાવી છે. સુંદર સિધ્યાંત છે. છોડની આ દુનિયામાં કાંટા પણ હોય છે અને કુલો પણ હોય છે. તેવીજ રીતે આ દુનિયામાં અજ્ઞાની પણ હોય છે અને જ્ઞાની પણ હોય જ છે! જેવી રીતે કુલો અને કાંટા વચ્ચે પસંદગી કરવાની આવે તો માનવ સ્વભાવિક રીતે જ કુલોને જ લેવા પસંદ કરશો. કાંટાઓથી

બચીને કુલો જ લઈ લેશો. તેવીજ રીતે માનવની દુનિયામાં અજ્ઞાનીઓ સાથે લડાઈ કર્યા વિના આપણો આપણી જુંદ્ઘી પસાર કરવાની છે.

અજ્ઞાનીઓ સાથે લડાઈ કરીને કે ઉલ્લભને માણસ સફળતા મેળવી શકતો જ નથી. તેથી ઉત્તમ રસ્તો એ છે અજ્ઞાનીને છોડીને પોતાના રસ્તે ચાલતા રહેવું. આ દુનિયામાંથી તમામ અજ્ઞાનીઓ દુર થઈ જાય તેવું થવાનું જ નથી. ગમે તેમ પણ અજ્ઞાનીઓથી દુર રહીને પોતાનું જવન સારી રીતે જવવાનું શક્ય જ છે. અજ્ઞાનીથી દુર રહેવું એ એવું છે જે રીતે આગથી દુર રહેવું. તે સમજો કે આગ ને ઓલવે છે.

(૮૦) ધીરજમાં જ સફળતા છે

પયગાભરે ઈસ્લામ(૩) ફરમાવે છે કે “જાણો લો કે ધીરજ-ધૈર્યમાં જ સફળતા છે.” (સંદર્ભ ગ્રંથ મુસનાટ એહમદ હદીસ નં. ૨૮૦૩). આ પયગાભર સાહેબ(૩)નું કથન અસાધારણ અગત્યતા ધૈર્યની બતાવે છે. ધૈર્ય એ જાણો પ્રગતિનું પગથીયું છે. ધીરજ ધરનાર કદીય નાસીપાસ થતો નથી?

સાંપ્રત સમયમાં દરેકના જવનમાં ચડતી પડતી આવે જ છે. મનુષ્ય જવનમાં અણગમતા સંજોગો ડગલે અને પગલે આવે જ છે. કયારેક એવું પણ બને છે માનવ હતાશ થઈ જાય છે અને તેને લાગે છે કે તે હારી ગયો છે. પરંતુ આ સારું નથી. સાંપ્રત સમયમાં સફળતાના એટલા બધા સંજોગો હોય છે કે તે પુરા જ થતા નથી. નિષ્ફળતાથી જ સફળતા મળે છે. હવે તમારે કરવાનું એ રહે છે કે તમારી જાતને હતાશથી બચાવીને બીજી તક આવે ત્યાં સુધી રાહ જોવાની છે. પ્રથમ હાર-નિષ્ફળતા પછી જો ધીરજ ધરીએ તો નજીકમાં જ બીજી સફળતા રાહ જોતી હોય છે. તેથી આપણો નિષ્ફળતાથી નાહિંમત ન થતાં સમજવું કે આ જ તે રસ્તો છે જેમાંથી સફળતા મળશે.

(૮૧) ઓછા અનિષ્ટ સાથે સંમત થવું

ઉમ્રે ઈબ્ને હબીબ ઈબ્ને ખમશાહ, પયગાભર સાહેબ(૩)ના એક સાથી ફરમાવે છે કે “જે માણસ ઓછા અનિષ્ટને સહન કરતો નથી તેને મોટા અનિષ્ટ ને સહન કરવાનું આવે છે.” (સંદર્ભ, ગ્રંથ અલ મુજમાલ અવસાત હદીસ નં. ૨૨૫૮).

અત્યારની દુનિયામાં પણ બુદ્ધિશાળી લોકો છે. સાથે સાથે અજ્ઞાની લોકો પણ છે જ. અજ્ઞાની લોકો બીજાને દુભવે છે કારણકે તેઓ અજ્ઞાની છે. શરૂઆતમાં આ નાનકડો પ્રશ્ન હોય છે. આવાને સહન કરવા માટે ડહાપણની જરૂર હોય છે. નાની વાતો માટે આવા ઓછી બુદ્ધિના લોકો સાથે નાની વાતોમાં ફસાવું ન જોઈએ. તેને સમજધારીથી કામ લેવું જોઈએ.

(૮૨) સહનશીલતાથી મુકાબલો કરો

પયગમખર સાહેબ(૩૩)ના વિખ્યાત સાથી અભુત્લાહ ઈંજો અભિસ કહે છે કે “અજ્ઞાનીની અજ્ઞાનતાનો સામનો સહનશીલતાથી કરો.” (સંદર્ભ ગ્રંથ તફસીર અલ ફુરતુબી, ભાગ-૧૫, પેઇઝ ઉદ્દી). આ અભિપ્રાય પ્રમાણે અભુત્લાહ ઈંજો અભિસ કહે છે તે પ્રમાણે એક બચાવની સુંદર રીત બતાવી છે કે બદલો લેવાથી દુર રહ્યો.

આ દુનિયામાં આવું વારંવાર બનતું જ હોય છે કે માણસને અજ્ઞાની લોકો સાથે વારંવાર કામ પડતું હોય છે. સહનશીલતા અપનાવવાથી પહેલી જ વખતમાં તેનો ઉપાય થાય છે. જો આપણો તેમની સાથે તેમની લાષામાં જ જવાબ આપીશું તો તેઓની દુષ્ટતા હદ બહાર જતી રહેશે.

(૮૩) ગુરુસો ન કરો

એક વખત આપ(૩૩)ના એક સાથીએ પયગમખર સાહેબને કહ્યું કે “મને એક એવી માસ્ટર ચાવી બતાવો કે જેનાથી મારા જીવનના બધા જ પ્રશ્નો હલ થઈ જાય”!! પયગમખર સાહેબએ કહ્યું કે “ગુરુસો ન કર.” (સંદર્ભ ગ્રંથ સહિહ બુખારી હઠીસ નં. ૬૧૧૬). અલબત્ આ એક બહુજ વિચારવાલાયક જવાબ છે, સલાહ છે. જો માણસ આ સલાહ માની લે તો જુંદ્ગીની ઘણી બાબતો સુધરી જાય. માણસ હમેશાં સમાજમાં રહે છે. તેને વારંવાર એવા બનાવો સાથે કામ પડતું હોય છે કે તે ગુરુસે થઈ જાય અને ઉશ્કેરાઈ જાય. માણસ જ્યારે ગુરુસે થાય છે તો તેની અંદર નફ્ફરત અને બદલાની લાવના જાગૃત થાય છે. તે તે માણસ સાથે બદલો લે છે. અને બદલો લેવાના લીધે એક બદલાનું વિષયક ચાલુ થાય છે. જો સારી રીતે સફળ જુંદ્ગી જીવની હોય તો આવી સ્થિતીમાં લાવના ઉપર કાબુ રાખીને ગુરુસો પી જવો જોઈએ. નકારાત્મક વાતોને હકારાત્મક રીતે જવાબ આપવો જોઈએ.

(૮૪) ગુરુસાનો ઉપાય

પયગમબરે ઈસ્લામ(૩)એ ફરમાવ્યું કે “જો માણસને ગુરુસો આવો તો જો તે ઊભો હોય તો બેસી જાય.” (સંદર્ભ ગ્રંથ સુનન અખુ દાઉદ હદીસ નં. ૪૭૮૨). જો તે વાતચીત કરતો હોયતો તેણે શાંત રહેવું જોઈએ.” (સંદર્ભ ગ્રંથ અલ મુસ્નાફ વોલ્યુમ (૧) પેઇજ ૩૨૮). આનો અર્થ એ થાય છે કે માણસે પોતાની સ્થિતી બદલવી જોઈએ. આ રીતે કરવાથી માણસની મનની સ્થિતી બદલાઈ જશે.

ગુરુસો એ એવો અજિન છે જે માણસને કોઈ અપ્રિય ઘટના અનુભવીને, અંદરો અંદર બાળી નાંખે છે. ગુરુસાથી જ માણસ ન કરવાનું કરી બેસે છે. તેથી ગુરુસામાં તે હમેશાં ગુમાવનાર જ બને છે. આવી સ્થિતીમાં તેણે મગજ ઠંકું થાય તેવું કામ કરવું જોઈએ. કોઈ સારા ઉપાયથી માણસ તુરંતજ ગુરુસા પર કાબુ મેળવી શકે છે. પરંતુ જો ગુરુસાને વધવા દેવામાં આવેતો તે રીપેર ન થઈ શકે તેવી હાની પહોંચાડે છે. ગુરુસો આવવો એ સ્વભાવિક પરંતુ તેના પર કાબુ ન કરી શકવું તે ખરાબ છે. ગુરુસા પર કાબુ ન કરી શકવો તે તો એવું છે જાણે પોતાને જ હરાવી દેવું.

(૮૫) શયતાનથી ઈશ્વરનો આશ્રય માંગવો

પયગમબરે ઈસ્લામ(૩)એ કહ્યું “શયતાન તમારો દુષ્મન છે તમને જ્યારે લાગે કે તે તમને ઉશ્કેરે છે ત્યારે કહો ઈશ્વર અમે તારા આશ્રયમાં આવીએ છીએ, શયતાનથી.” (સંદર્ભ ગ્રંથ કન્જુલ ઉમ્માલ હદીસ નં. ૨૨૦૭૩).

શયતાન માણસનો દુષ્મન છે. તે ઈચ્છે છે કે માણસ રાખમાં મળે! તે છાનામાના ગણગાણાટથી ઈચ્છે છે કે માનવ સત્યથી હટી જાય. શેતાન અદૃશ્ય ગુપ્ત હુમલા માનવો પર કરે છે. આ અટકાવવાનો એકજ ઉપાય છે કે તેનાથી ઈશ્વરનો આશ્રય માંગવામાં આવે. ઈશ્વર ખાગી આપે છે કે જો શયતાનથી ઈશ્વરનો આશ્રય માંગવામાં આવશે તો તે આશરો જરૂર આપશે. આ એક જ ઉપાય છે શયતાનથી બચવાનો.

(૮૬) શક્તિશાળી કોણ?

પયગમબરે ઈસ્લામ(૩)એ કહ્યું કે પહેલવાન કે મુક્કાબાજ એ નથી જે બીજાને કુશ્ટીમાં પછાડી દે. પરંતુ સાચો મુક્કાબાજ એ જે ગુરુસાના સમયે પોતાના ઉપર કાબુ રાખે !!

(સંદર્ભ ગ્રંથ સહિત બુખારી હસ્તિસ નં. ૬૧૧૪). ખરેખર માણસની આ ઉચ્ચતમ તાકાત છે. બીજાને શારીરિક રીતે હરાવી દેવું તે મોટી તાકાત નથી. આવું તો જનાવર પણ કરી શકે છે. સૌથી મોટી શક્તિ માનવ માટે એ છે કે તે ગુસ્સે થાય અને તુરતજ તેના પર કાબુ પામી જાય!! ગુસ્સો હોવા છતાંય માનવતા વિરુદ્ધનું કામ ન કરે. ગુસ્સો તેના ઉપર કાબુ ન મેળવે પરંતુ તે ગુસ્સા ઉપર કાબુ મેળવી લે !!

(૮૭) તકલીફમાં રાહત

કુરઆના કથન અનુસાર “કુદરતના નિયમ પ્રમાણે જેના ઉપર આ દુનિયા ચાલે છે કે દરેક મુસીબત પછી રાહત આવે જ છે.” (સંદર્ભ ગ્રંથ કુરઆન ૮૪/૫-૬). મુસીબતો અને અવરોધોની સાથે સાથે તેને ધ્યાન બધા રસ્તાઓ હોય છે જ. આ કુદરતનો શાખત નિયમ છે. અને તેમાં ફેરફાર થતો નથી. હડીકિત એ છે કે આ વિશ્વમાં શક્યતાઓ હમેશાં મુશ્કેલીઓ કરતાં વધી જાય છે. મનુષ્ય ઉપર મુસીબતો આવે તો તેણે નિરાશાને કદીય સ્થાન ન આપવું જોઈએ. ખાસ કરીને જયારે પડકારો અને સમર્થ્યાઓ આવે ત્યારે. માણસે ત્યારે જ તેની બુદ્ધિમતાનો ઉપયોગ કરવો જોઈએ. તો તેને ખબર પડશે કે આ મુશ્કેલીઓ સાથે અપાર તકો પણ છે જ, જે તેને દેખાતી નહતી. એક તક ગુમાવી તો બીજી તક ઉસી જ હોય છે. જરૂર છે ફક્ત તેને શોધવાની અને ઝડપી લેવાની! જેનાથી તે આગળ વધી શકશે. ઉત્તમ માં (ઉત્તમ સૂત્ર) એ જ છે કે પડકારોની અનદેખી કરીને તકોને ઝડપી જ લો. આપણે અપ્રિય સંજોગોને અને નિષ્ફળતાને, સફળતામાં પરિણમીને અનુકૂળ બનાવવા સખત મહેનત કરવી જોઈએ. આ યોગ્ય ખાનીગ-આયોજનથી જ શક્ય થશે.

ઈશ્વરની આ દુનિયામાં માણસ પોતાની બુદ્ધિનો યોગ્ય ઉપયોગ કરીને નકારાત્મક વાતોને હકારાત્મક બનાવી શકે છે. જરૂર છે ફક્ત યોગ્ય હિંમતની! તેના માટે દરેક શક્યતાઓ છે જે હકારાત્મક બને અને મુસીબતો થી હિંમત ન હારે.

(૮૮) સરળ રસ્તો પસંદ કરો

ઉમ્મુલ મોઅમેનીન હજરત આયેશા સિદ્દીક (રضي الله عنهما) (પયગમ્બર સાહેબના પુનિત પણી) ફરમાવે છે કે જયારે જયારે પયગમ્બર સાહેબ (ﷺ)ને બે વાતોમાંથી એક વાત પસંદ

કરવાની આવતી તો આપ હમેશાં આસાન વાતને પસંદ કરતા. (સંદર્ભ ગ્રંથ સહિત બુખારી હાઇસ નં. ૩૫૬૦). આનો અર્થ એ થયો કે જ્યારે જ્યારે પયગમ્બર સાહેબને બે વિકલ્પો માંથી એક વિકલ્પની પસંદગી કરવાની આવતી તો આપ હમેશાં આસાન વિકલ્પ પસંદ કરતા. (કારણ તેનાથી નાહકની તકલીફીથી બચી જવાય છે!!). તેવીજ રીતે જ્યારે જ્યારે પયગમ્બર સાહેબને કોઈ બે વિકલ્પો માંથી એકની પસંદગી કરવાની આવતી કે Avoidence-નિવારણ અને Confrontation-મુકાબલો તો આપ હમેશાં મુકાબલાને છોડીને નિવારણની રીત અપનાવતા. તેવીજ રીતે સ્વભાવિકપણે જ્યારે આપને લડાઈ અને શાંતિ બન્ને માંથી કોઈ એક વાત પસંદ કરવાની આવતી તો આપ હમેશાં શાંતિને જ પસંદ કરતા!

આ ડહાપણ કહેવાય! આ રીતે જ માણસનું ડહાપણ દેખાય છે કે તે વધારે નુકશાન તથાને પોતાનું કામ સફળતા પૂર્વક પાર પાડે છે. દરેક સિથ્તીમાં આ બન્ને રીતો હાજર હોય છે. પરંતુ ડહાપણ એ જ છે જે પયગમ્બરે ઈસ્લામ(ૢ)ની જીંદગી આપણાને બતાવે છે.

(૮૮) તમને જે ન ગમતું હોય પણ તે તમારા માટે સારું પણ હોય!

ખુલ્ગા તથાલા કુરાન શરીફમાં ફરમાવે છે કે “કોઈ વાત તમને ખરાબ લાગતી હોય, તમને અન્ય ચીજ પસંદ હોય પરંતુ તમને જે ગમતું ન હોય તે બની શકે છે કે તમારા માટે સારું હોય.” (કુરાન ૨/૨૧૬). આ કુરાનની આયત જીવનની હકીકત પ્રત્યે નિર્દ્દશ કરે છે. સામાન્યાં: માણસો બાહ્ય દેખાવ પસંદ કરે છે, તેમને બહારનો દેખાવ જ પસંદ આવે છે. તે જે આકર્ષક ન હોય તેને પસંદ કરતા નથી. પરંતુ સાચું જોતાં આ યોગ્ય રસ્તો, પસંદગીનો નથી. ઘણ્ણી વખત એવું બને છે કે આપણને બાહ્ય દેખાવથી કોઈ વાત પસંદ ન આવે પરંતુ હકીકતમાં એ વાત તમારા માટે બધુજ પસંદીદા હોય. પરિણામની દ્રષ્ટિથી એ ઉત્તમ હોય. માણસે બહારની ચીજ જોઈને પસંદગી ન કરવી જોઈએ.

(૧૦૦) એક પ્રાર્થના

પયગમ્બર સાહેબ(૩)ની ગાગરમાં સાગર જેવી એક પ્રાર્થના છે કે “અય ઈશ્વર મને સત્યને સત્યના રૂપમાં બતાવ જેથી હું તેના પર ચાલી શકું અને મને અસત્યને અસત્યના રૂપમાં

(જ) બતાવ જેથી હું તેનાથી બચી શકું.” (સંદર્ભ ગ્રંથ શરહ અલ મુન્તહા અલ ઈરાવાત વોલ્યુમ ૩, પેઈજ ૪૮૭).

સાંપ્રત સમાજમાં સૌથી મહત્વની બાબત એ છે કે ઉદ્દેશ્યપૂર્ણ વિચારસરણી ધરાવવી. તે આ પયગમ્બર સાહેબ(૧)ના કથનમાં બતાવવામાં આવ્યું છે. આ પ્રાર્થનાના સુંદર સ્વરૂપમાં દર્શાવવામાં આવ્યું છે. અત્યારના વિશ્વમાં માણસ એવી પરિસ્થિતીમાં જીવે છે કે તેને સત્ય અસત્યના રૂપમાં દેખાય છે અને અસત્ય સત્યના રૂપમાં દેખાય છે. આ પ્રાર્થનામાં ઈશ્વરને વિનંતી કરવામાં આવી છે કે અમને આ ભૂલથી બચાવજો. તેના પ્રત્યુત્તરમાં ઈશ્વર તેને ઓંતરજ્ઞાન આપશે અને તેની દ્વારા જેવું છે તેવું જ દેખાશે. યોગ્ય ચિંતનથી યોગ્ય વિચાર આવે છે અને યોગ્ય વિચાર યોગ્ય કાર્ય તરફ લઈ જાય છે, અને યોગ્ય કાર્ય હમેશાં સક્ષળતા તરફ દોરી જાય છે.

આ પયગમ્બરી પ્રાર્થનામાં બતાવવામાં આવ્યું છે કે માનવજીત સત્યને અત્યના રૂપમાં અને અસત્યને અસત્યના રૂપમાં જોવા ટેવાયેલી નથી. આ સમર્સ્યા (conditioning) અનુકૂલનના લીધી થાય છે. દરેક માનવ અલગ અલગ સ્થિતીમાં અલગ અલગ જગ્યાએ ઉછરે છે. બચપણથી લઈને યુવાની સુધી તેના પર જે વાતાવરણમાં રહ્યા હોય તેની જ અસર રહે છે, જે અપુષ્ટતાની વયમાં હોય છે. આને કહેવાય છે અનુકૂલન! પરંતુ માણસ જ્યારે પુષ્ટ બને ત્યારે તેણે પોતાના વિશે ફરીથી વિચાર કરવો જોઈએ. તેણે પોતાનો અંતરાત્માને જાગૃત કરવો જોઈએ. પોતાનું વલણ બદલવું જોઈએ. જેમ એ વિચારે છે તે સ્તરે પોતાની જાતને લઈ જવી જોઈએ. જ્ઞાનનો મહત્વમ લાભ એ છે કે તે માણસને સત્ત્વાન બનાવે છે અને પોતાનું વલણ બદલવા તત્પર રહે છે. તેનાથી આપણી માન્યતાની કિયાઓ નું વલણ બદલાય છે. આનાથી આપણને જે વસ્તુ જેવી છે તેવીજ દેખાય છે.



કેતુમય જવના હોલ્ડ સિધ્યાંતો
